Suzlon Energy Ltd.

One Earth, Hadapsar, Pune - 411 028, India



Phone : +91.20.61356135 / 67022000 Fax : +91.20.67022100 / 67022200

E-mail: pune@suzlon.com URL: www.suzlon.com

6th March 2023.

National Stock Exchange of India Limited, "Exchange Plaza", Bandra-Kurla Complex, Bandra (East), Mumbai-400051. **BSE Limited** P.J. Towers, Dalal Street, Mumbai-400001.

Dear Sirs,

Sub.: Advertisement for despatch of First & Final Call Money Notice to the shareholders of Suzlon Energy Limited (the 'Company').

Ref.: Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Further to our letter dated 4th March 2023 informing about despatch of First & Final Call Money Notice to the shareholders of the Company, please note that the Company has issued following advertisement in all the editions of English national daily newspaper, "Financial Express", all the editions of Hindi national daily newspaper, "Jansatta", and Ahmedabad edition of Gujarati newspaper, "Jai Hind":

• First & Final Call Notice to the holders of Partly Paid-up Equity Shares (ISIN: IN9040H01011) of the Company as on the Record Date, i.e. Thursday 2nd March 2023, published on 6th March 2023.

We hereby submit the Advertisement in 'pdf' format.

This is for your information as also for the information of your members and the public at large.

Thanking you,

Yours faithfully, For Suzlon Energy Limited

Geetanjali S.Vaidya, Company Secretary.

Encl.: As above.

FINANCIAL EXPRESS

HINDENBURG REPORT AFTERMATH

Adani Group has \$2-billion US, Europe; sees FY23 sales at 900K bonds to repay in 2024 Seet India has Delivery in the company, which has completed 25 years of operations in India. The company is headquartered in Puncy, which has completed 25 years of operations in India. The company is headquartered in Puncy in the first in the sum of the f

AMMAR ZAIDI New Delhi, March 5

THE ADANI GROUP, whose mostly debt-fuelled breakneck expansion saw its gross debt doubling in four years, has almost \$2 billion worth of foreign-currencybonds coming up for repayment in 2024, according to a presentation the conglomerate made to investors.

The apples-to-airport conglomerate borrowed over \$10 billion in foreign currency bonds between July 2015 and 2022 across group companies. Of this, \$1.15 billion of bonds matured in 2020 and 2022.

There are no maturities in 2023 but three issuances —



Adani Group

\$650 million by the ports arm APSEZ and two of renewable energy unit Adani Green Energy (\$750 million and and \$500 million — are due for

ment, including chief financial officer Jugeshinder Singh, last month held roadshows in Singapore and Hong Kong to reassure investors that the company's finances are under control. These are to be extended to Dubai, London and the US from March 7 to 15. Executives told investors they will address upcoming debt maturities, including by potentially offering private placement notes and using cash from operations.

The Adani Group's gross debt has grown from ₹1.11 trillion in 2019 to ₹2.21 trillion in 2023, according to the presentation made to investors last month. After including cash, the net

There are no foreign currency bond maturities in 2025 but have \$1 billion of repay-

report by a US short-seller lopped off \$135 billion in market value from Adani Group's listed companies, it is hoping to claw back the narrative now by

John Deere India exports tractors to

JOHN DEERE INDIA has exported fully built tractors from its India plant to the US, Japan, Germany and other parts of Europe.

The company had shifted a line to manufacture the 5M range of its high-end higher horsepower tractors in India during the Covid-19 pandemic to leverage the manufacturing and supply base in the country. Shailendra Jagtap, managing

director and country manager, India, John Deere, said the company exported tractors made in India to 110 countries and the 5M was the latest series to be exported out of the country. These are tractors in the 75-130 HP range and are being manufactured exclusively for the export markets. The company is



at present exporting around 35% of its total production.

Jagtap said the company is not only exporting tractors but also components and electronic systems from India. There are 80 Indian suppliers of John Deere India who have now become global suppliers and are playing a part in the advanced products being developed by Deere globally, he added.

In addition, John Deere India is also developing products, providing engineering and IT supIndia, is also exporting components and electronic systems from India

port to the global operations with a 4,400-strong team located in Pune and Bengaluru.

Mukul Varshney, region 1 director(corporate affairs), John Deere, said it will continue to invest and leverage manufacturing, talent and India's supply chain to serve farmers in India and around the world, with growth expected in both the domestic and export markets.

John Deere India, a subsidiary of John Deere Singapore (an arm of Deere & Co), has

Date : 06th March 2023

Place: Kolkata

recently completed 25 years of operations in India. The company is headquartered in Pune with a plant at Sanaswadi near Pune with a capacity to make 72,000 tractors, and in Dewas, Madhya Pradesh, which has the capacity to manufacture 60,000 units of the 5000 Series of tractors in India. The company had a customer base of 700,000 with around 10% share of the Indian tractor market and a leading position in the 45 HP and higher range.

The country's total tractor sales in FY23 are expected to be at 900,000 units and FY24 is also expected to remain at a similar level, but this would depend on the monsoon, Jagtap said. Apart from tractors, John

Deere now also has a road construction firm in India which was part of the global acquisition of Wirtgen Group.

Why is Sebi yet to get to the bottom of Mauritius funds' ownership: Rajan

PRESS TRUST OF INDIA New Delhi, March 5

FORMER RBI GOVERNOR Raghuram Rajan has asked why Sebi has not yet got to the bottom of ownership of the four Mauritius-based funds which are said to have parked 90% of their \$6.9-billion in Adani Rajan, former Group stocks.

The funds — Elara India Opportunities Fund, Cresta Fund, Albula Investment Fund and APMS Investment Fund — have been under transparent links between governcloud for the last few years after allegations that they may be

PUBLIC NOTICE

Notice is hereby given that M/s. ICRA Limited, a credit rating agency registered with the Securities and Exchange Board of India, no longer holds any relationship or association with any entity or person in the capacity of marketing associate or advisor for providing any referrals/leads to ICRA for its credit rating business. ICRA advises the public at large not to deal

with any entity or person claiming itself/ himself to be a marketing associate or advisor of ICRA. ICRA does not take the responsibility of any such acts, deeds, commitment and things of whatsoever nature. Further, it is hereby clarified that ICRA does not give or issue any advance or indicative ratings.

For & on behalf of ICRA Limited

Record Date for the same.

HDFC TaxSaver - IDCW Option


Name of the Scheme / Plan(s) / Option(s)

HDFC TaxSaver - IDCW Option - Direct Plan

HDFC Housing Opportunities Fund - IDCW Option

HDFC Housing Opportunities Fund - IDCW Option -

Auth. Signatory



alleged that Adani

NMDC Limited

Khanij Bhavan', 10-3-311/A, Castle Hills, Masab Tank, Hyderabad -500028

Corporate Identity Number (CIN) - L13100TG1958GOI001674

CONTRACTS DEPARTMENT

Tender Enquiry No: HO(Contracts)/Services/FF Central wing/Khanij Bhavan/2023/919, Dt:06/03/2023

MSTC Ref. No.: NMDC/HO/96/22-23/ET/957, Estimated cost including GST is Rs 3.06 Cr

NMDC Limited, A "NAVARATNA" Public Sector Company under Ministry of Steel, Govt. of

India, invites online bids from prospective bidders for the work of "Renovation of First Floor

The detailed NIT and Bid documents can be viewed and /or downloaded from 06/03/2023 to

Central Public Procurement portal – https://www.eprocure.gov.in/epublish/app and

MSTC portal - https://www.mstcecommerce.com/eprochome/nmdc/buyer_login.jsp

The bidders are requested to submit their bids online through MSTC Limited website. The details

of submission of bid through online are given in NIT. The Bidders on regular basis are required to

For further clarification, the following can be contacted - Chief General Manager (Contracts),

NMDC Limited Hyderabad, Tel no. +91-040-23532800, email: (1) contracts@nmdc.co.in;

हर एक काम देश के नाम

For and on behalf of NMDC Ltd, Chief General Manager (Contracts)

Net Asset Value | Amount of | Face Value

(₹ per unit)#

5.75

1.00

Distribution (₹ per unit)

10.00

10.00

("NAV") as on

March 3, 2023

(₹ per unit)

58.107

72,456

12.340

13.087

MUTUAL

visit the NMDC's website/CPP Portal/MSTC website for corrigendum, if any, at a future date.

Group used offshore shell firms to inflate stock price. Adani Group has

RBI governor

repeatedly denied all allegations.

"The issue is of reducing non-

Central wing of NMDC Khanij Bhavan, Hyderabad".

search tender through tender enquiry number

. NMDC website - https://tenders.nmdc.co.in/nmdctender/

For further help refer to 'vendor guide' given in MSTC website

05/04/2023 from following website links;

II HDFC

MUTUAL FUND

BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited

A Joint Venture with abrdn Investment Management Limited

CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation,

Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676

Fax: 022 22821144 • e-mail: hello@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

NOTICE is hereby given that HDFC Trustee Company Limited, Trustee to HDFC Mutual Fund

("the Fund"), has approved the following distribution under Income Distribution cum Capital Withdrawal

("IDCW") Option of HDFC TaxSaver and HDFC Housing Opportunities Fund and fixed Thursday.

March 9, 2023 (or the immediately following Business Day, if that day is not a Business Day) as the

ment and business, and of letting, indeed encouraging, regulators do their job. Why has Sebi not yet got to the bottom of the ownership of those Mauritius funds which have been holding and trading Adani stock? Does it need help from the investigative agencies?" Rajan asked.

Because funds are registered in tax haven Mauritius, their ownership structure is opaque.

Cresta, Albula and Elara have been subject to at least one probe for alleged



Regd. Office: IIFL Centre, 6th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400013 CIN: U74900MH2010PLC201113

follows:					
Sr. No.	Existing Name	Proposed Name			
1.	IIFL Asset Management Limited	360 ONE Asset Management Limited			
2.	IIFL Trustee Limited	360 ONE Asset Trustee Limited			
3.	IIFL Mutual Fund	360 ONE Mutual Fund			
Consequent to the change in name of the above-mentioned entities, the Schemes of IIFL					

Mutual Fund ("IIFLMF") shall be renamed as 360 ONE XXXX. For instance, the name of IIFL Focused Equity Fund will be modified as 360 ONE Focused Equity Fund. A references to the existing name of the Schemes wherever appearing in the Statement of Additional Information/ Scheme Information Document and Key Information Memorandum & Application Forms shall be replaced with the new name. All other features such as type, investment objective, asset allocation pattern and terms and conditions etc. of the Schemes shall remain unchanged.

Subsequent to the above modification and in compliance with the provisions of SEB (Mutual Fund) Regulations, 1996, the Trust Deed is proposed to be amended with prior approval of the unitholders through postal ballot process.

scrutinizing the conduct of postal ballot exercise in a fair and transparent manner. Details of postal ballot particularly the terms of voting, mode of voting, timelines for sending duly filled-in and signed ballot papers, manner of determining the results of postal ballot, etc are mentioned in the Letter to Unitholder which is being sent separately along with the proposed Draft Supplemental Deed of Trust.

any of the designated Investor Service Centers of IIFL Mutual Fund.

READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY" For IIFL Asset Management Limited

Place: Mumbai

Authorised Signatory

SUZLON

Suzlon Energy Limited

Registered Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 028, Maharashtra, India Tel: +91 20 6702 2000; Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer

indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28" September 2022. read with addendum dated 10th October 2022 filed with the BSE Limited ("BSE") and the National Stock Exchange of India Limited ("NSE"), the stock exchanges, where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as "Stock Exchanges") and the Securities and Exchange Board of India ("SEBI").

FIRST AND FINAL CALL NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9040H01011) OF SUZLON ENERGY LIMITED AS ON THE RECORD DATE, I.E., THURSDAY, 2ND MARCH 2023.

This is to inform that the Securities Issue Committee of the Board of Directors of the Company at its meeting held on Friday, 24" February 2023, approved making of the First and Final Call of ₹ 2.50 (Rupees Two and Paise Fifty Only) per Rights Equity Share (out of which ₹ 1.00 will be adjusted towards the face value and ₹ 1.50 will be adjusted towards securities premium) ("First and Final Call") on the outstanding 240,00,00,000 (Two Hundred Forty Crores) partly paid-up equity shares of the Company having a face value of ₹ 2.00 each with ₹ 1.00 paid-up ("Rights Equity Shares"), which were allotted on 31" October 2022 on a rights basis pursuant to the Letter of Offer dated 28" September 2022 read with addendum dated 10" October 2022.

Further, Thursday, 2" March 2023, has been fixed as the "Record Date" for the purpose of determining the holders of partly paid-up Rights Equity Shares to whom the call notice for the payment of First and Final Call will be sent. The same was intimated to the stock exchange on Friday, 24" February 2023.

Company has sent the First and Final Call Notice in the electronic mode to the members holding partly paid-up equity shares whose e-mail address is registered with the Company or the Registrar and Transfer Agent ("RTA") or Depository Participant(s) on the Record Date unless the members have registered their request for the hard copy of the same. Physical copy of the First and Final Call Notice along with instructions and ASBA form have been sent vide permitted modes of despatch, at the registered addresses of those shareholders (a) who have not registered their e-mail address with the Company or the RTA or the Depository Participant(s); or (b) who have specifically registered their request for the hard copy of the same. The Company has completed the despatch on 4"March 2023.

Accordingly, the details regarding making payment for First and Final Call are given below:

Call Money	From	To	Duration			
Payment Period	Thursday, 9* March 2023	Thursday, 23rd March 2023	15 Days			
Mode of Payment	(a) Online ASBA: by visiting the website of SCSBs* offering the online ASBA facility; (b) Physical ASBA*: by submitting the duly filled up ASBA Form at the designated branch of the SCSBs*;					
	(c) Payment through 3-in-1 account: by using 3-in-1 type accounts, provided by some of the registered brokers.					
	*Please visit					
	https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognised Id=34 to refer to the list of existing SCSBs (for points (a) and (b) above).					
	*Please Visit Company's website <u>www.suzlon.com</u> or RTA's weblink https://rights.kfintech.com/callmoney to download the Physical ASBA applic					

In accordance with SEBI Circular no.SEBI/HO/CFD/DIL1/CIR/238/2020 dated 8" December 2020, shareholders can also make a call money payment by using of linked online trading-demat-bank account (3-in-1 type accounts) provided by some of the brokers. Shareholders must login in to their demat account and choose the name of the company "SUZLON ENERGY LIMITED" and further click on the option to 'Make Call Money Payment' and proceed accordingly. Shareholders to note that this payment method can be used only if the concerned broker has made the facility available to their customers. The Company or the Registrar will not be responsible for non-availability of this payment method to the shareholders.

equity shares of the Company comprising of ₹ 2.50 (Rupees Two and Paise Fifty Only) with effect from 2¹⁰ March 2023. and accordingly the ISIN IN9040H01011 representing partly paid-up equity shares has been suspended by National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL).

Upon completion of the corporate action, the partly paid-up equity shares shall be converted into fully paid-up equity shares and would be credited to ISIN INE040H01021, allotted by NSDL/CDSL.

All correspondence in this regard may be addressed to KFin Technologies Limited, Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India, Tel. No.+91 40 6716 2222; Toll Free No.1800 309 4001; Email id: einward.ris@kfintech.com; website: www.kfintech.com; Contact Person: M Murali Krishna.

For Suzlon Energy Limited

Date: 4th March 2023

Place: Pune

Company Secretary

Requirement: HNGIL intends to procure Cullet - White, Green and Amber (sorted & cleaned) for all plants as mentioned above For more details, kindly send email on: hngil.quotations@gmail.com For Hindusthan National Glass & Industries Limited Resolution Professional for Hindusthan National Glass & Industries Limited

Resolution Professional to carry out the CIRP of the Corporate Debtor.

(A company under Corporate Insolvency Resolution Process by NCLT

INVITATION FOR QUOTATION FOR PROCUREMENT OF CULLET FOR HINDUSTHAN NATIONAL GLASS &

INDUSTRIES LIMITED

Last date and time for submission of Quotation: 13/03/2023 (06:00 PM)

-findustan National Glass and Industries Limited ("HNGIL/Corporate Debtor") is a public limited company domiciled in India under the Companies Act, 2013. It is engaged in the manufacturing of

The Company has six operating plants at Rishra, Bahadurgarh, Rishikesh, Sinnar, Naidupeta 8

ondicherry. HNGIL is currently undergoing Corporate Insolvency Resolution Process ("CIRP"

as per the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, as amended from time to

me ("Code"), pursuant to the orders dated October 21, 2021, passed by Hon'ble National Company Law Tribunal, Kolkata Bench ("NCLT"). Mr. Girish Siriram Juneja was appointed as the

> order dated October 21,2021) IBBI/IPA001/IP-P00999/2017-2018/11646 E-mail Id: junejagirish31@gmail.com; hng.irp21@gmail.com

FORM B
PUBLIC ANNOUNCEMENT (Regulation 12 of the Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016 FOR THE ATTENTION OF THE STAKEHOLDERS OF MADHUR NOURISHMENT PRODUCTS LLP

PARTICULARS MADHUR NOURISHMENT PRODUCTS LLP Name of corporate debtor Date of incorporation of corporate debtor 02/02/2016 Authority under which corporate debtor ROC Mumba is incorporated / registered Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor Address of the registered office C-713 BSEL Tech Park, Plot No.39/5 & 39/5A Sector 30A, Opp.: Vashi Railway Station, Vashi, and principal office (if any) of Navi Mumbai, Mumbai City, Maharashtra 400703. corporate debtor Date of closure of Insolvency Resolution Process Liquidation commencement 01/03/2023 date of Corporate Debtor Name and registration number Mr. Prashant Jain of the insolvency professional Registration No. IBBI/IPA-001/IP-P01368/2018-2019/12131 acting as liquidator Address and e-mail of the liquidator, Add: A501, Shanti Heights, Plot No. 2,3,9B/10, as registered with the Board Sector 11, Koparkharine, Thane, Navi Mumbai-400709 Email id: ipprashantjain@gmail.com Address and e-mail to be used for Mr. Prashant Jain SSARVI Resolution Services LLP correspondence with the liquidator Add: B-610, BSEL Techpark, Sector 30 A. Opp. Vashi Railway Station, Navi Mumbai -400703 Website: www.ssarvi.com/

Notice is hereby given that the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench has ordered the commencement of the liquidation of the MADHUR NOURISHMENT PRODUCTS The stakeholders of MADHUR NOURISHMENT PRODUCTS LLP are hereby called upon to

11. Last date for submission of claims

Email: lig.madhurnourishment@gmail.com

submit their claims with proof on or before 31/03/2023, to the liquidator at the address mentioned The financial creditors shall submit their claims with proof by electronic means only. All other

creditors may submit the claims with the proof in person, by post or by electronic means Submission of false or misleading proofs of claim shall attract penalties. n case a stakeholder does not submit its claims during the liquidation process, the claims submitted by such a stakeholder during the corporate insolvency resolution process under the

nsolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016, shall be deemed to be submitted under section 38. Mr. Prashant Jain Registration No.: IBBI/IPA-001/IP-P01368/2018-2019/12131

Liquidator in the matter of Madhur Nourishment Products LLP PUBLIC NOTICE FOR SURRENDERING OF CERTIFICATE OF REGISTRATION OF MERCHANT BANKER

ALMONDZ GLOBAL SECURITIES LIMITED almondz

(hereinafter referred to as "AGSL") (CIN: L74899DL1994PLC059839) Registered Office: F-33/3,Okhla Industrial Area Phase-II, New Delhi -110020 Phone Number: 011-43500700; Fax: 011-43500734/5 Website: www.almondzglobal.com; Email Id: info@almondz.com

PUBLIC NOTICE

his notice is hereby given to all the concerned parties, clients and public at large that, we,

ALMONDZ GLOBAL SECURITIES LIMITED, having its registered office at F-33/3, Okhla Industrial Area Phase-II, New Delhi -110020, are registered merchant banker in accordance with the applicable provisions of Securities Exchange Board of India (Merchant Bankers) Regulations, 1992, bearing registration number: INM000000834. Consequent to restructuring in our Group, we are transferring our Capital Market Division (including merchant banking operations) from AGSL to its 100% wholly owned subsidiary viz, Almondz Financial Services Limited ("AFSL"), (on a slump sale basis). The online application for grant of fresh registration in the name of AFSL has been approved by Securities and Exchange Board of India ("SEBI"). Therefore, in accordance with the directions provided by SEBI, we, AGSL, are issuing this notice to inform the public at large that we are initiating the process of surrendering of certificate of registration of merchant banker. All clients & related infrastructure of AGSL will also be transferred to AFSL. For any further clarifications/ concerns, please contact the undersigned

> For Almondz Global Securities Ltd. Ajay Pratap

Company Secretary & Sr. Vice President Corporate Affairs

PUBLIC NOTICE FOR SURRENDERING OF CERTIFICATE OF REGISTRATION OF RESEARCH ANALYST

ALMONDZ GLOBAL SECURITIES LIMITED

Date: March 04, 2023.

Date: March 04, 2023

Place: New Delhi

Place: New Delhi

almondz

(hereinafter referred to as "AGSL") (CIN: L74899DL1994PLC059839) Registered Office: F-33/3, Okhla Industrial Area Phase-II, New Delhi -110020 Phone Number: 011-43500700; Fax: 011-43500734/5 Website: www.almondzglobal.com; Email Id: info@almondz.com

PUBLIC NOTICE This notice is hereby given to all the concerned parties, clients and public at large that, we,

ALMONDZ GLOBAL SECURITIES LIMITED, having its registered office at F-33/3, Okhla Industrial Area Phase-II, New Delhi -110020, are registered Research Analyst in accordance with the applicable provisions of Securities Exchange Board of India (Research Analysts) Regulations, 2014, bearing registration number: INH100004872. Consequent to restructuring in our Group, we are transferring our Capital Market Division (including research analyst operations) from AGSL to its 100% wholly owned subsidiary viz, Almondz Financial Services Limited ("AFSL"), (on a slump sale basis). The online application for grant of fresh registration in the name of AFSL has been approved by Securities and Exchange Board of India ("SEBI"). Therefore, in accordance with the directions provided by SEBI, we, AGSL, are issuing this notice to inform the public at large that we are initiating the process of surrendering of certificate of registration of Research Analyst, All clients & related infrastructure of AGSL will also be transferred to AFSL. For any further clarifications/ concerns, please contact the undersigned.

For Almondz Global Securities Ltd.

Ajay Pratap Company Secretary & Sr. Vice President Corporate Affairs

financialexp.epap.in

Place: Mumbai







payment in 2024.

ments due in 2026. A month after a damning

> choosing slow and steady growth over the breakneck, mostly debt-fuelled, expansion spree of recent years. It has already scrapped a ₹7,000-crore coal plan purchase, decided not to bid for a stake in state-backed PTC, reined in expenses, repaid some debt and promised to repay more.

IIFL ASSET MANAGEMENT LIMITED

www.iiflmf.com

NOTICE IS HEREBY GIVEN to all unitholder(s) of IIFL Mutual Fund that, pursuant to the
approval of the Securities and Exchange Board of India ("SEBI") vide its letter dated
February 01, 2023 the names of the IIFL Asset Management Limited (AMC), IIFL Trustee
imited (Trustee Company) and IIFL Mutual Fund (Trust) are proposed to be modified as
follows:

follows:	Trustee Company / and m E Mutuat	Tund (Trust) are proposed to be modified as
Sr. No.	Existing Name	Proposed Name
1.	IIFL Asset Management Limited	360 ONE Asset Management Limited
2.	IIFL Trustee Limited	360 ONE Asset Trustee Limited
3.	IIFL Mutual Fund	360 ONE Mutual Fund
Canadaus	ent to the change in name of the ob	vove mentioned entities the Cohemes of IIEI

In this regard, M/s Nilesh Shah & Associates, has been appointed as Scrutinizer for

In case any existing Unit holder has not received postal ballot, they are advised to contact

"MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,

Date: March 05, 2023

E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com; Corporate Identity Number: L40100GJ1995PLC025447 This is only an advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or

In terms of the provisions of the Companies Act, 2013, read with the relevant rules made thereunder (the "Act"), the

Can money	FIOIII	10	Duration			
Payment Period	Thursday, 9 th March 2023	Thursday, 23 rd March 2023	15 Days			
Mode of Payment	 (a) Online ASBA: by visiting the website of SCSBs* offering the online ASBA facility (b) Physical ASBA*: by submitting the duly filled up ASBA Form at the designate branch of the SCSBs*; 					
	(c) Payment through 3-in-1 account: by using 3-in-1 type accounts, provided some of the registered brokers.					
	*Please visit					
	https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecog ld=34 to refer to the list of existing SCSBs (for points (a) and (b) about "Please Visit Company's website www.suzlon.com or RTA's web https://rights.kfintech.com/callmoney to download the Physical A					
		and the same and t				

The BSE and NSE have issued notices for suspension of trading in ISIN IN9040H01011 representing partly paid-up

Geetanjali S.Vaidya

Adfactors 590

The amount will be paid, net of applicable tax deducted at source (TDS), to those Unit holders / Beneficial Owners whose names appear in the Register of Unit holders maintained by the Fund / Statements of Beneficial Ownership maintained by the Depositories, as applicable, under the IDCW Option(s) of the aforesaid Schemes on the Record Date (including investors whose valid purchase / switch-in requests are received by the Fund and the funds are available for utilization before cut-off timings in respect of the aforesaid Schemes, on the Record date).

The amount of distribution per unit will be the lower of the rate mentioned above or the available

distributable surplus (rounded down to a multiple of five at the third decimal) as on the Record Date.

Pursuant to the Distribution, the NAV of the IDCW Option(s) of the above Schemes

would fall to the extent of such distribution and statutory levy, if any.

With regard to Unit holders who have opted for Reinvestment facility under the IDCW Option(s) of HDFC Housing Opportunities Fund, the distribution amount (net of applicable TDS) will be reinvested, by allotting Units at the ex-Distribution NAV per Unit (net of applicable stamp duty).

Unit holders are advised to note that for redemptions and IDCW declared with effect from January 13. 2023, as per amended SEBI regulations, payout will be done only through electronic mode(s), even where a Unit holder has opted to receive physical instruments. Thus, payment of such amounts shall be made through physical instruments only in exceptional circumstances for reasons to be recorded by the AMC. Accordingly, unit holders who have opted for / have earlier received physical instruments are requested to update their bank account details by / sending us a copy of a cancelled cheque of first / sole holder's bank account.

forwarded to the Investor Services Centers of the Fund (for units held in non-demat form) / Depository Participant (for units held in demat form). Unit holders are also advised to link their PAN with Aadhaar Number. Further, Unit holders can view the Investor Charter available on website of the Fund as well as check for any unclaimed redemptions or IDCW payments.

All updations of PAN, KYC, email address, mobile number, nominee details, etc. should immediately be

In view of individual nature of tax consequences, each investor should seek appropriate advice.

(Investment Manager to HDFC Mutual Fund) Authorized Signatory

For HDFC Asset Management Company Limited

Date : March 5, 2023 MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

कि इलाहाबाद देहरादून फोन नं०: 2713957, 2713976 शुद्धि - पत्र : ई-नीलामी

वित्तीय आस्तियों का प्रतिभूतिकरण व पुनर्गठन तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम, 2002 (सरफेसी) के अन्तर्गत दिनांक 01.03.2023 को अचल सम्पत्तियों का ई-नीलामी चल/अचल संपत्तियों की सार्वजनिक बिक्री सूचना के लिए प्रकाशित सूचना में अंशतः संशोधन किया जाता है कि बकाया राशि कॉलम में दिनांक 19.02. | 2008 की जगह 30.06.2008 पढ़ा जाए। अन्य |विवरण यथावत् रहेगें। दिनांक : 06.03.2023 स्थान : रुडकी प्राधिकृत अधिकारी

> [देखें विनियमन 32(2)] कार्यालयः रिकवरी अधिकारी-I/II ऋण वसूली अधिकरण दिल्ली (डीआरटी 1) 4था तल, जीवन तारा बिल्डिंग, संसद मार्ग, नई दिल्ली-110001

ऋण वसूली एवं दिवालिया अधिनियम, 1993 के साथ पठित आयकर अधिनियम, 1961 की द्वितीय अनुसूची के नियम 53 के अंतर्गत बिक्री उद्घोषणा के निर्धारण के लिये सुचना आरसी/421/2018

बैंक ऑफ महाराष्ट्र

मै. श्रृष्टि फैशन क्रिएटर

(सीडी 1) मै. श्रष्टि फैशन क्रिएटर द्वारा उसके प्रॉप्राईटर, श्री संदीप गोस्वामी, डी-56, प्रथम तल, ओल्ड डबल स्टोरी मार्केट, लाजपत नगर-IV,

जैसा कि ऋण वसूली अधिकरण दिल्ली (डीआरटी 1) के प्राधिकृत अधिकारी जिन्होंने **ओए**/554/2017 में वसूली प्रमाणपत्र तिथि 16.10.2018 जारी किया था, के द्वारा आपको आवेदक बैंकों/वित्तीय संस्थानों (आवेदक का नाम) को रु. 29200153.00 (रु. दो करोड़ बानवे लाख एक सौ तिड़ेपन मात्र) के साथ 21.7.2017 से वसूली तक विलम्बित तथा 13.00% प्रति वर्ष साधारण दर पर आगे के ब्याज तथा रु. 150000 (रु. एक लाख पचास हजार मात्र) की लागत का भुगतान करने का निर्देश दिया था तथा जैसा कि उक्त भुगतान नहीं किया गया है, अतः अधोहस्ताक्षरी ने नीचे वर्णित अचल/अचल सम्पत्ति की बिक्री का आदेश दिया है।

2. एतदुद्वारा आपको सचित किया जाता है कि बिक्री उद्घोषणा तैयार करने तथा उसकी शर्तों को निर्धारित करने के लिये 16.3.2023 को 10.30 बजे पूर्वा. का समय निर्धारित किया गया है। आपको निर्देशित किया जाता है कि उक्त सम्पत्ति अथवा उसके किसी भाग से जुड़ी यदि कोई अधिभार, चार्जेज, दावे अथवा देयताएँ हो तो उसे अधोहस्ताक्षरी की जानकारी के लिये अवगत कराएें।

सम्पत्ति का विनिर्देशन डी-56, 1ला तल, पुराना डबल स्टोरी मार्केट, लाजपत नगर-4, नई दिल्ली में स्थित गिरवी सम्पत्ति अर्थात् कार्यालय सह गोदाम, माप 1107 वर्ग फीट

मेरे हाथ से तथा अधिकरण की मुहर लगाकर आज दिनांक 16.2.2023 को दी गई। रिकवरी अधिकारी

ऋण वसुली अधिकरण दिल्ली (डीआरटी-I)

टिप्पणीः जो लागू नहीं हो उसे काट दें।

सेवा में.

सार्वजनिक उद्घोषणा [भारत दिवाला तथा दिवालिया मंडल (कॉर्पोरेट व्यक्तियों के लिए दिवाला प्रस्ताव प्रक्रिया) विनियमन, 2016 के विनियमन 6 के अंतर्गत] टेलीविजन होम शॉपिंग नेटवर्क लिमिटेड के क्रेडीटरों के ध्यानार्थ

संबंधित विवरण 2. कॉर्पोरेट ऋणधारक के निगमन की तिथि 13.06.2006 वह प्राधिकरण जिसके अंतर्गत कॉर्पोरेट ऋणधारक कॉर्पोरेट कार्य मंत्रालय, आरओसी-मुम्बई निगमित/पंजीकृत है 4. कॉर्पोरेट पहचान संख्या/कॉर्पोरेट ऋणधारक का U93091MH2006PLC281105 लिमिटेड लाएबिलिटी पहचान संख्या प्रिधान कार्यालय का पता मुम्बई, मुम्बई सिटी एमएच-400602 आईएन कॉर्पोरेट कार्यालयः ए-48, सेक्टर 67, गौतम बध नगर नोएडा-201301, उ.प्र., आईएन में बेरमेन्ट तथा मैजेनिन तर आरंभ होने की तिथि संख्या, जो अंतरिम प्रस्ताव प्रॉफेश्नल IBBI/IPA-001/IP-P02136/2020-2021/13281 (आईआरपी) के रूप में कार्यरत है 9. बोर्ड में यथा पंजीकत अंतरिम प्रस्ताव प्रॉफेश्नल ्रपताः बी 803. बिल्डिंग, नं. 10. 25 पोडडरवाडी, शाहजी का पता एवं ईमेलः राजे मार्ग, निकट ठक्कर बेकरी, कोलडोंग्री, विले पार्ले (ईस्ट), मुम्बई सिटी, महाराष्ट्र, 400057 ईमेलः avafca@gmail.com लिये प्रयुक्त होने वाला पता तथा ईमेल मुम्बई, महाराष्ट्र-400002 ईमेलः televisionhome.ibc@gmail.com धारा (6ए) के उपबंध (बी) के अंतर्गत, अंतरिम प्रस्ताव प्रॉफेश्नल द्वारा सुनिश्चित किया गया

एतदुद्वारा सुचित किया जाता है कि माननीय राष्ट्रीय कम्पनी विधि अधिकरण (एनसीएलटी), मुम्बई पीठ-IV ने सीपी (आईबी) नं. 4002/एम बी–IV/2019 तिथि 03.03.2023 के माध्यम से टेलीविजन होम शॉपिंग नेटवर्क लिमिटेड के संदर्भ में कॉर्पोरेट इन्सॉल्वेन्सी प्रस्ताव प्रक्रिया शुरू करने का आदेश दिया है। एतद्द्वारा टेलीविजन होम शॉपिंग नेटवर्क लिमिटेड के क्रेडीटरों को निर्देश दिया जाता है प्रविष्टि सं.10 में वर्णित पते पर अंतरिम प्रस्ताव प्रॉफेशनल वे पास 17.3.2023 को या उससे पूर्व प्रमाण के साथ अपने दावे जमा करें। फाइनांसियल क्रेडीटर्स केवल इलेक्टॉनिक पद्धति से ही प्रमाण के साथ अपने दावे जमा कर सकते हैं। अन्य सर्भ

ख) लागू नहीं

ख) प्राधिकृत प्रतिनिधियों का विवरण उपलब्ध है home/downloads पर उपलब्ध है।

क) संबंधित प्रपत्र https://www.ibbi.gov.in/

क्रेडीटर्स व्यक्तिगत, डाक द्वारा अथवा इलेक्ट्रॉनिक माध्यमों से प्रमाण के साथ अपने दावे जमा कर सकते हैं। दावे का गलत अथवा भ्रामक प्रमाण जमा करने पर दंडित किया जा सकता है।

सुशील कुमार अग्रवाल तिथि: 04.03.2023 अंतरिम प्रस्तात कर्म स्थानः कोलकाता IBBI/IPA-001/IP-P02136/2020-2021/13281 एएफए की वैधता-09.11.2023 तक

अनुसंघान विश्लेषक के पंजीकरण के प्रमाण पत्र के आत्मसमर्पण के लिए सार्वजनिक सुचना

अलमोंड्ज ग्लोबल सिक्योरिटीज लिमिटेड

(इसके बाद "एजीएसएल" के रूप में संदर्भित) (सीआईएन: L74899DL1994PLC059839) पंजीकृत कार्यालयः एफ-33/3, ऑखला औद्योगिक क्षेत्र फेज-11, नई दिल्ली -110020 फोन नंबर: 011-43500700, फैक्स: 011-43500734/5 वेबसाइटः www.almondzglobal.com; ईमेल आईडीः info@almondz.com

सार्वजनिक सूचना यह नोटिस एतद्दवारा सभी संबंधित पक्षों, ग्राहकों और आम जनता को दिया जाता है कि, हम अल्गोंडज ग्लोबल सिक्योरिटीज लिमिटेड, जिसका पंजीकृत कार्यालय एफ-33/3, ओखला औद्योगिक क्षेत्र फेज—।।, नई दिल्ली—110020 में है, भारतीय प्रतिभृति विनिमय बोर्ड (अनुसंघान

विश्लेषक) विनियम, 2014 के लागू प्रावधानों के अनुसार पंजीकृत अनुसंधान विश्लेषक हैं, पंजीकरण हमारे समूह में पुनर्गठन के परिणामस्वरूप, हम अपने कैपिटल मार्केट डिवीजन (रिसर्च एनालिस्ट ऑपरेशंस सहित) को AGSL से इसकी 100% पूर्ण स्वामित्व वाली सहायक कंपनी जैसे कि अल्मोंडज ग्लोबल सिक्योरिटीज लिमिटेड ("AFSL"), (मंद बिक्री के आधार पर) में स्थानांतरित कर रहे हैं। एएफएसएल के नाम पर नया पंजीकरण प्रदान करने के लिए ऑनलाइन आवेदन को भारतीय प्रतिभति और विनिमय बोर्ड ("सेबी") द्वारा अनुमोदित किया गया है। इसलिए सेबी द्वारा प्रदान किए गए निर्देशों के अनुसार, हम, एजीएसएल, बड़े पैमाने पर जनता को सूचित करने के लिए यह नोटिस जारी

कर रहे हैं कि हम अनुसंधान विश्लेषक के पंजीकरण के प्रमाण पत्र को सरेंडर करने की प्रक्रिया शुरू

कर रहे हैं। एजीएसएल के सभी ग्राहक और संबंधित बुनियादी ढांचे को भी एएफएसएल में

स्थानांतरित कर दिया जाएगा। किसी और स्पष्टीकरण / कंसर्न के लिए, कृपया अधोहस्ताक्षरी से संपर्क करें।

कृते अल्मोंडज ग्लोबल सिक्योरिटीज लिमिटेड हस्ता/-

दिनांक 04.03.2023 अजय प्रताप ख्यान : नई दिल्ली कंपनी सचिव और वरिष्ठ उपाध्यक्ष कॉर्पोरेट मामले

अनुसंघान विश्लेषक के पंजीकरण के प्रमाण पत्र के आत्मसमर्पण के लिए सार्वजनिक सूपना

अलमोंड्ज ग्लोबल सिक्योरिटीज लिमिटेड

almondz the game changer

(इसके बाद "एजीएसएल" के रूप में संदर्भित) (सीआईएन: L74899DL1994PLC059839) पंजीकृत कार्यालयः एफ-33/3, ओखला औद्योगिक क्षेत्र फंज-11, नई दिल्ली -110020 फोन नंबर: 011-43500700, फैक्स: 011-43500734/5 वेबसाइटः www.almondzglobal.com; ईमेल आईडीः info@almondz.com

सार्वजनिक सचना यह नोटिस एतदवारा सभी संबंधित पक्षों, ग्राहकों और आम जनता को दिया जाता है कि, हम, अल्मोंड्ज ग्लोबल सिक्योरिटीज लिमिटेड, जिसका पंजीकृत कार्यालय एफ-33/3, ओखला औद्योगिक क्षेत्र फेज-।।, नई दिल्ली-110020 में है, भारतीय प्रतिभृति विनिमय बोर्ड (अनुसंधान विश्लेषक) विनियम, 2014 के लागू प्रावधानों के अनुसार पंजीकृत अनुसंधान विश्लेषक हैं, पंजीकरण

हमारे समूह में पुनर्गठन के परिणामस्वरूप, हम अपने कैपिटल मार्केट डिवीजन (रिसर्च एनालिस्ट ऑपरेशंस सहित) को AGSL से इसकी 100% पूर्ण स्वामित्व वाली सहायक कंपनी जैसे कि अल्मॉड्ज ग्लोबल सिक्योरिटीज लिमिटेड ("AFSL"), (मंद बिक्री के आधार पर) में स्थानांतरित कर रहे हैं। एएफएसएल के नाम पर नया पंजीकरण प्रदान करने के लिए ऑनलाइन आवेदन को भारतीय प्रतिभृति और विनिमय बोर्ड ("सेबी") द्वारा अनुमोदित किया गया है। इसलिए, सेबी द्वारा प्रदान किए गए निर्देशों के अनुसार, हम, एजीएसएल, बड़े पैमाने पर जनता को सुचित करने के लिए यह नोटिस जारी

कर रहे हैं कि हम अनुसंधान विश्लेषक के पंजीकरण के प्रमाण पत्र को सरेंडर करने की प्रक्रिया शुरू कर रहे हैं। एजीएसएल के सभी ग्राहक और संबंधित बुनियादी ढांचे को भी एएफएसएल में स्थानांतरित कर दिया जाएगा। किसी और स्पष्टीकरण / कंसर्न के लिए, कृपया अधोहस्ताक्षरी से संपर्क करें।

कृते अल्गोंड्ज ग्लोबल सिक्योरिटीज लिमिटेड

हस्ता/-दिनांक 04.03.2023 अजय प्रताप

प्रपत्र सं. आईएनसी-26 [कम्पनी (निगमन) नियमावली, 2014 के

नियम 30 के अनुपालन में] एक राज्य से दूसरे राज्य में कम्पनी के पंजीकृत कार्यालय के परिवर्तन के लिये समाचार पत्र में

प्रकाशन के लिए विज्ञापन केन्द्र सरकार, उत्तरी क्षेत्र के समक्ष कंपनी अधिनियम, 2013 की धारा 13 की उप-धारा (4) तथा कम्पनी (निगमन) नियमावली, 2014 के नियम 30 के उप-नियम (5) के क्लॉज (ए) के मामले में

मार्स मेडिकल एंड रेडियोलॉजिकल सर्विसेस प्राईवेट लिमिटेड जिसका पंजीकृत कार्यालय 5580-81, लाहोरी गेट, नया बाजार, सेन्ट्रल दिल्ली, दिल्ली-110006 में है, के मामले में

एतदुद्वारा आम जनता को सूचित किया जाता है कि 'राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली'' से ''हरियाणा राज्य'' में उसके पंजीकृत कार्यालय को परिवर्तित करने के लिए कंपनी को सक्षम बनाने के लिए 20 जनवरी, 2023 को आयोजित असाधारण आमसभा में पारित विशेष प्रस्ताव के अनुसार कंपनी के मेमोरैंडम ऑफ एसोसिएशन के परिवर्तन की पुष्टि के लिए कम्पनी अधिनियम, 2013 की धारा 13 के अंतर्गत यह आवेदक कंपनी केन्द्र सरकार के पास

आवेदन करने का प्रस्ताव करती है। कंपनी के पंजीकृत कार्यालय के इस प्रस्तावित परिवर्तन से यदि किसी व्यक्ति का हित प्रभावित होता हो, वे एमसीए-21 पोर्टल (www.mca.gov.in) पर निवेशक शिकायत प्रपत्र दाखिल करें अथवा उसके नीचे वर्णित पंजीकृत कार्यालय में आवेदक कंपनी को उसकी एक प्रति के साथ इस सूचना के प्रकाशन की तिथि से चौदह दिनों के भीतर अपने हित की प्रकृति तथा आपत्ति के कारणों का उल्लेख करते हुए एक शपथ पत्र द्वारा समर्थित अपनी आपत्ति क्षेत्रीय निदेशक उत्तरी क्षेत्र, बी-2 विंग, 2रा तल, पर्यावरण भवन, सीजीओ कॉम्प्लैक्स, नई दिल्ली-110003 में जमा करें या जमा कराएं या पंजीकृत डाक से भेजें: 5580-81, लाहोरी गेट, नया बाजार,

सेन्ट्रल दिल्ली, दिल्ली-110006 आवेदक के लिये तथा उसकी ओर से मार्स मेडिकल एंड रेडियोलॉजिकल सर्विसेस प्राईवेट लिमिटेड राहुल कत्याल तिथिः 6.3.2023 निदेशक

DIN: 01811706

स्थानः नई दिल्ली

लायड राकफाइबस लिभटेड

नई दिल्ली-110019 दूरभाषः 011-26462157, ई-मेलः punjgp13@gmail.com सीआईएनः U20293DL1989PLC218564

प्रथम असाधारण सामान्य बैठक की सूचना तथा ई–मतदान जानकारी एतद्दवारा सूचना दी जाती है कि लॉयड रॉकफाइबर्स लिमिटेड के सदस्यों की 01/2022-23 असाधारण आम बैठक (ईजीएम) शुक्रवार, 31 मार्च, 2023 3:00 अपराह (आईएसटी) को कंपनी के पंजीकृत कार्यालय प्लॉट नंबर 2, पूंजसंस प्रिमाइसेज, कालकाजी औद्योगिक क्षेत्र, नई

दिल्ली-110019 में आयोजित की जाएगी। 01वीं / 2022-23 असाधारण सामान्य बैठक (ईजीएम) के नोटिस की इलेक्ट्रॉनिक प्रतियां उन सभी शेयरधारकों को भेज दी गई हैं, जिनकी ईमेल आईडी कंपनी के रजिस्ट्रार एंड शेयर ट्रांसफर एजेंट, बीटल फाइनेंशियल एंड कंप्यूटर सर्विस प्राइवेट लिमिटेड के पास पंजीकृत हैं। जब तक सदस्यों ने अनुमत्य विधि के अंतर्गत अपने पंजीकृत पते पर भौतिक प्रतियों में उसी की हार्ड कॉपी और अन्य सदस्यों के लिए अपने अनुरोध को पंजीकृत नहीं किया है।

कंपनी अधिनियम, 2013 की धारा 108 और उसके तहत बनाए गए नियमों के अनुसार, कंपनी अपने शेयरधारकों को 01/2022-23 असाधारण सामान्य बैठक (ईजीएम) की सूचना में निर्धारित सभी संकल्पों पर इलेक्ट्रॉनिक माध्यम से अपना वोट डालने की सुविधा प्रदान करके प्रसन्न है। कंपनी ने रिमोट ई-वोटिंग सेवाओं की सुविधा के लिए सेंट्रल डिपॉजिटरी सर्विसेज लिमिटेड ('सीडीएसएल') के साथ एक व्यवस्था की हैं। कंपनी अधिनियम, 2013 के प्रावधान और नियमों के अनुसार विवरण नीचे दिया गया है:

(1) नोटिस भेजने की पूर्णता की तिथिः 04 मार्च, 2023 (2) इलेक्ट्रॉनिक माध्यम से मतदान प्रारंभ होने की तिथि और समयः 28 मार्च, 2023 को सुबह

(3) इलेक्ट्रॉनिक माध्यम से मतदान की समाप्ति की तिथि और समयः 30 मार्च, 2023 को शाम

(4) 30 मार्च, 2023 को शाम 5.00 बजे के बाद इलेक्ट्रॉनिक माध्यम से मतदान की अनुमित नहीं

(5) इलेक्ट्रॉनिक माध्यम से मतदान करने की पात्रता निर्धारित करने की अंतिम तिथि 24 मार्च

(6) सदस्य रिमोट ई-वोटिंग के माध्यम से अपने मतदान के अधिकार का प्रयोग करने के बाद भी असाधारण आम बैठक में भाग ले सकते हैं, लेकिन उन्हें बैठक में दोबारा मतदान करने की अनुमति नहीं दी जाएगी। (7) जिन व्यक्तियों का नाम सदस्यों के रजिस्टर में दर्ज है या डिपॉजिटरी द्वारा बनाए गए लाभार्थी

स्वामियों के रजिस्टर में कट-ऑफ तारीख को दर्ज है वे ही रिमोट ई-वोटिंग के साथ-साथ आम बैठक में वोटिंग की सुविधा का लाभ उठाने के हकदार होंगे। (8) ईजीएम के समय मतपत्रों के माध्यम से मतदान करने की सुविधा उपलब्ध कराई जाएगी और बैठक में भाग लेने वाले सदस्य जिन्होंने रिमोट ई-वोटिंग द्वारा अपना वोट नहीं डाला

है, वे बैठक में मतपत्रों के माध्यम से अपने अधिकार का प्रयोग कर सकेंगे (9) कोई भी व्यक्ति जो कंपनी के शेयरों का अधिग्रहण करता है और नोटिस भेजने के बाद कंपनी का सदस्य बनता है और कट—ऑफ तिथि अर्थात 3 मार्च, 2023 को शेयर रखता है, वह www.evotingindia.com.in पर या इश्यूअर/आरटीए को एक अनुरोध भेजकर लॉगिन आईडी और पासवर्ड प्राप्त कर सकता है।

(10) इलेक्ट्रॉनिक वोटिंग निर्देश के लिए शेयरधारक 01 / 2022–23 असाधारण आम बैठक (ईजीएम) की सूचना में दिए गए निर्देशों को पढ़ सकते हैं और इलेक्ट्रॉनिक वोटिंग से संबंधित किसी भी प्रश्न / शिकायत के मामले में, शेयरधारक www.evotingindia.com के हेल्प सेक्शन के तहत डाउनलोड सेक्शन में उपलब्ध शेयरधारकों के लिए अक्सर पूछे जाने वाले प्रश्नों (एफएक्यू) और ई-वोटिंग यूजर मैनुअल का संदर्भ ले सकते हैं या helpdesk.evoting@cdslindia.com पर एक ईमेल लिख सकते हैं।

> निदेशक मण्डल के आदेशानुसार कृते लॉयड रॉकफाइबर्स लिमिटेड हस्ता./-

> > गौरव पुज

(प्रबंध निदेशक)

डीआईएन नं.: 00822420

कब्जा

सूचना

स्थान : नई दिल्ली दिनांक : 06-03-2023 10, पृथ्वी राज रोड, दिल्ली-110011

माहन्द्रा रूरल हाउसिंग फाइनांस लिमिटेड Mahindra

कॉर्पोरेट कार्यालय: महिन्द्रा रूरल हाउसिंग फाइनांस लिमिटेड, साधना हाउस, 2रा तल, 570, पी.बी. मार्ग वर्ली, मुम्बई 400018, भारत टेली: +91-22 66523500, फैक्स: +91-22-24972741

आरओ कार्यालय⁄लखनऊ शाखा का पता : 2 रा तल, अशोका राज टावर, प्लॉट नं. सीधी-162, सेक्टर डी-1, एलडीए कॉलोनी, पावर हाउस चौराहा के निकट, आशियाना, लखनऊ, उ.प्र.-226012

जैसा कि, वित्तीय परिसम्पत्तियों के प्रतिभूतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्त्तन अधिनियम, 2002 (2002 के 54) के अंतर्गत में महेन्द्रा रूरल हाउसिंग फाइनांस लि. (यहां के बाद ''एमआरएचएफएल'' वर्णित) जिसका पंजीकत कार्यालय लखनऊ तथा शाखा कार्यालय लखनऊ में है के प्राधिकत अधिकारी के रूप में तथा प्रतिभित हित (प्रवर्तन) नियमावली, 2002 के नियम 3 के साथ पठित धारा 13 (12) के अंतर्गत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए अधोहस्ताक्षरी ने मांग सुचना उक्त अधिनियम की धारा 13(2) के अंतर्गत जारी कर आप, ऋणधारकों (नाम एवं पता नीचे वर्णित) को उक्त सूचना की प्राप्ति की तिथि से 60 दिनों के भीतर सूचना में वर्णित राशि वापस लौटाने का निर्देश दिया था। उक्त ऋणधारक, इस राशि को वापस लौटाने में विफल रहे, अतः एतदहारा ऋणधारकों ऊपर वर्णित तथा आम जनता को सचित किया जाता है कि अधोहस्ताक्षरी ने उक्त प्रतिभृति हित प्रवर्त्तन नियमावली 2002 के नियम के साथ पठित अधिनियम की धारा 13 की उप-धारा (4) के अंतर्गत उन्हें प्रदत्त शक्तियों का प्रयोग करते हुए अधोहस्ताक्षरी ने यहां नीचे वर्णित सम्पत्ति का सांकेतिक कब्जा कर लिया है।

(अचल सम्पत्ति के लिये)(प्रतिभृति हित (प्रवर्तन) नियमावली, 2002 के नियम 8(1) के अंतर्गत)

विशेष रूप से उक्त ऋणधारकों तथा आम जनता को एतदहारा सतर्क किया जाता है कि वे यहां नीचे वर्णित सम्पत्ति का व्यवसाय न करें तथा इन सम्पत्तियों का किसी भी तरह का व्यवसाय नीचे वर्णित राशि तथा ब्याज के लिये मै. महिन्द्रा रूरल हाउसिंग फाइनांस लि. के चार्ज के अधीन होगा ऋणधारक का ध्यान प्रतिभत परिसम्पत्तियों को विमोचित करने के लिए उपलब्ध समय के संदर्भ में अधिनियम की धारा 13 की उप-धारा (8) के प्रावधानों के प्रति आकष्ट की जाती है।

क्रम सं.	ऋणधारक ∕गारंटरों का नाम	प्रतिभूत परिसम्पत्ति (अचल सम्पत्ति का विवरण)	मांग सूचना तिथि एवं राशि	सांकेतिक कब्जा की तिथि
1.	(LC No: 443584 लखनऊ शाखा) मुजीबुर रहमान (ऋणधारक) अमीना बानों (सह-ऋणधारक) मोह. अकील (गारंटर) पता : 538 केएचए/2 रूपूर खदरा नम्बरदार की चक्की, लखनऊ, उ.प्र226022	मकान सं. ई-702, सेक्टर-1, एलडीए कॉलोनी, कानपुर रोड, जिला-लखनऊ, उ.प्र 226022, चौहद्दी : पूर्व : रामदीन का मकान, पश्चिम : प्लॉट सत जरीना, उत्तर : 20' चौड़ा रोड, दक्षिण : अलीमुद्दीन एवं सलीम का मकान	হ. 1043204/−	03.03.23 सांकेतिक कब्जा
स्थ	ान : लखनऊ, तिथि : 6.3.2023	प्राधिकृत अधिकारी,	महिन्द्रा रूरल हार्डा	संग फाइनांस लि.

OSBI भारतीय स्टेट बैंक ई-नीलामी सूचना

द्वितीय तल, 2- तिलक मार्ग, नेशनल पी.जी. कॉलेज के निकट, लखनऊ-226001

अचल सम्पत्तियों के विक्रय हेत विक्रय सचना

ई-नीलामी की तिथि और समय: 22.03.2023 और समय: 300 मिनट पूर्वाह्व 11:00 बजे से अपराह्व 04:00 बजे तक (बिक्री केवल ई-नीलामी के माध्यम से)

प्रतिभृति हित (प्रवर्तन) नियम, 2002 के नियम 8 (6) के साथ पठित वित्तीय आस्तियों का प्रतिभृतिकरण और पुनर्गठन तथा प्रतिभृति हित (प्रवर्तन) नियम, 2002 के अधीन अचल आस्तियों के विक्रय हेतू ई-नीलामी विक्रय सूचना एतहवारा आम जनता को और विशेष रूप से ऋणी और गारंटर को नोटिस दिया जाता है कि नीचे वर्णित अचल संपत्ति सरक्षित लेनदार को बंधक/चार्ज की गई है, जिसका रचनात्मक कब्जा प्राधिकत अधिकारी एसबीआई द्वारा लिया गया है। SARB LUCKNOW सरक्षित लेनदार, 22,03,2023 को "जैसा है जहाँ है", "जैसा है जो है"और "जो कुछ भी है" पर बेचा जाएगा। नीचे उल्लिखित उधारकर्ता विवरण से देय राशि की वसूली के लिए, आरक्षित मूल्य और बयाना राशि निम्नानुसार है। ईएमडी राशि ई-नीलामी शुरू होने पर या उससे पहले जमा की जानी है।

उधारकर्ता/बंधक/गारंटर का नाम और पता : 1. भूपेंद्र कुमार पुत्र रमेश चंद्र 32 अशोक नगर, कस्वा बाबरपुर औरया उत्तर प्रदेश 206121 श्रीमती शिश गृप्ता पत्नी भूपेंद्र कुमार कस्बा बाबरपुर, औरैया, उत्तर प्रदेश 206121 बंधक संपत्ति का विवरण : 1. श्रीमती शशि गुप्ता पत्नी भूपेंद्र कुमार के स्वामित्व वाली संपत्ति मकान नंबर 32 अशोक नगर कस्बा

बाबरपुर। भूमि एवं भवन मोहल्ला नवीन नगर, बाबरपुर परगना अजीतमल, जिला औरैया में स्थित। टाइटल डीड नं. 4423 दिनांक 13.08. 2008 क्षेत्रफल 52,287 वर्गमीटर ।

सीमाएँ : पूर्व : रतन कुमार और शांति स्वरूप का घर, पश्चिम : डॉ ऑकार चतुर्वेदी, उत्तर : शमशाद का घर, दक्षिण : औरैया इटावा रोड 2, शशि गुप्ता पत्नी भूपेंद्र कुमार के स्वामित्व वाली संपत्ति मकान नं. 32 अशोक नगर कस्बा बाबरपर। भूमि एवं भवन मोहल्ला नवीन नगर.

बाबरपुर परगना अर्जातमल, जिला औरया स्थित। टाइटल डॉड नः ४५१९ दिनाक २१.०८.२००८ क्षेत्रफल २०.०८ वर्गमीटर सीमाएँ : पूर्व : रतन कुमार और शान्ति स्वरूप का घर, पश्चिम : डॉ ओंकार चातुर्वेदी, उत्तर : शशि गुप्ता का घर, दक्षिण : ओरैया इटावा

बकाया राशि: Rs. 22,46,474.00/- दिनांक 05.03.2022 + ब्याज एवं अन्य खर्चे तत्पाश्चत् जमा/वसूली राशि यदि कोई हो तो उसे

आरक्षित मुल्य और अग्रिम धन: Rs. 36,02,000.00/- और Rs. 3,60,200.00/-

उधारकर्ता/बंधक/गारंटर का नाम और पता : (i) मैसर्स श्री बिहारीजी इंडस्टीज (प्रोपराइटर कामता प्रसाद गुप्ता) पता : एफ-62 पनकी इंडस्ट्रीज एरिया पनकी साइट नंबर 2 जिला कानपुर (ii) श्री कामता प्रसाद गुप्ता पुत्र श्री सोहन लाल गुप्ता पता : एफ-62 पनकी औद्योगिक क्षेत्र पनकी साइट नंबर 2 जिला कानपुर (iii) श्रीमती अंजू गुप्ता पत्नी कामता प्रसाद गुप्ता पता : एफ-62 पनकी औद्योगिक क्षेत्र पनकी साइट नंबर 2 जिला कानपुर (Iv) श्री अनंत गुप्ता पुत्र श्री कामता प्रसाद पता : एफ-62 पनकी औद्योगिक क्षेत्र पनकी साइट नंबर 2 जिला कानपुर वंधक संपत्ति का विवरण : फेक्टी परिसर में स्थित भवन एवं दृष्टिबंधक संयंत्र और मशीनरी एफ-62, पनकी साइट नंबर 6, कानपुर। क्षेत्रफल 617.50 वर्ग मीटर जो कि श्री कामता प्रसाद गुप्ता के नाम पर

सीमाएँ : पूर्व : प्लॉट नंबर एफ-63, पश्चिम : प्लॉट नंबर एफ-61, उत्तर : 460-सी चौड़ा रोड दक्षिण : 80 'सी ' चौड़ा रोड बकाया राशि : Rs. 9,94,01,411.00 दिनांक 21.03.2022 + ब्याज एवं अन्य खर्चे तत्पाश्चत् जमा/वसुली राशि यदि कोई हो तो उसे

आरक्षित मूल्य और अग्रिम धन : Rs. 1,43,19,000.00 और Rs. 14,31,900.00

'बैंक देय राशि के लिए जमा राशि, यदि कोई हो, को कल देय राशि से घटाया जाएगा, यदि लागु हो।

एन्कम्ब्रेन्स- बैंक को ज्ञात नहीं है।

बिक्रों के विस्तृत नियमों और शर्तों के लिए, कृपया भारतीय स्टेट बैंक, एसएआरबी, लखनऊ (सिक्योर्ड क्रेडिटर) वेबसाइट में दिए गए लिंक को देखें : – वेबसाइट यानी www.sbi.co.in & https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp # प्राधिकृत अधिकारी के ज्ञान एवं जानकारी के अनुसार संपत्ति/ संपत्तियों पर कोई अधिभार नहीं है। यद्यपि इच्छुक बोलीकर्ताओं को अपनी बोली प्रस्तुत करने से पहले संपत्ति का अधिभार, नीलामी में प्रस्तुत संपत्ति/संपत्तियों के टाईटल एवं दावों/अधिकारों/बकाया/ संपत्ति को प्रभावित करने वाले अन्य जानकारी अवश्य ले लेनी चाहिए। ई-नीलामी विज्ञापन बैंक के किसी भी प्रतिनिधित्व का गठन नहीं माना जाएगा। संपत्ति के सभी मौजुदा एवं भविष्य के अभिभार के साथ बेचा जा रहा है, चाहे वह बैंक को ज्ञात हो या न हो। प्राधिकृत अधिकारी/सुरक्षित लेनदार किसी भी तीसरे पक्ष के दावों/अधिकारों/बकाया के लिए जिम्मेदार नहीं होगा। बिक्री वित्तीय नियमों के प्रतिभृतिकरण और पुनर्गठन एवं प्रतिभृति हित का प्रवर्तन अधिनियम, 2002 के तहत निर्धारित नियमों/शर्तों के अधीन होगी।

नोट: "इच्छुक बोलीदाता ई-नीलामी के बंद होने से पहले एमएसटीसी के पास प्री-बिड ईएमडी जमा कर सकता है। प्री-बिड ईएमडी का क्रेडिट बोलीदाता को एमएसटीसी के बैंक खाते में भगतान की प्राप्ति और ई में ऐसी जानकारी के अपडेशन के बाद ही दिया जाएगा। ई-नीलामी वेबसाइट। इसमें बैंकिंग प्रक्रिया के अनुसार कुछ समय लग सकता है और इसलिए बोलीदाताओं को, अपने हित में, किसी भी अंतिम मिनट की समस्या से बचने के लिए बोली-पूर्व ईएमडी राशि अग्रिम रूप से जमा करने की सलाह दी जाती है।"

प्राधिकृत अधिकारी, भारतीय स्टेट बैंक दिनाँक: 05.03.2023 स्थान: लखनऊ



नियम 8(1) आधिपत्य सूचना (अचल संपत्ति हेतु)

जबकि, अधो-हस्ताक्षरकर्ता ने **सेवा गृह ऋण लिमिटेड** का प्राधिकृत अधिकारी होते हुए वित्तीय आस्तियों का प्रतिभूतिकरण एवं पूर्नगठन और प्रतिभृति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(2) और प्रतिभृति हित प्रवर्तन तहत प्रदत्त शक्तियों का प्रवर्तन करके मांग नोटिस जारी कर, ऋणी/सह-ऋणी/जमानतदार से सूचना प्राप्ति दिनांक से 60 दिन के अन्दर ऋण राशि अदा करने की अपेक्षा की गई थी।

ऋणी / सह-ऋणी / जमानतदार के यह राशि लौटाने में विफल होने पर ऋणी / सह-ऋणी / जमानतदार एवं सर्व साधारण को एतद द्वारा सूचना-पत्र दिया जाता है कि अधोहस्ताक्षरकर्ता ने उक्त अधिनियम की धारा 13(4) सपठित उक्त नियम के नियम 8(1) के तहत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए नीचे वर्णित सम्पत्ति का आधिपत्य ग्रहण कर लिया है ।

विशेष रुप से ऋणी और सामान्य रुप से जनता को एतदद्वारा सूचित किया जाता है कि वे संपत्ति का लेन-देन न करें और संपत्ति के साथ कोई भी व्यवहार **सेवा गृह ऋण लिमिटेड** के प्रभार के अधीन होगा, जिसमें नीचे दी गई बकाया राशि के साथ-साथ ब्याज और आकस्मिक व्यय, लागतें शामिल हैं। ऋणी का ध्यान प्रतिभृति आस्तिया के मोचन के लिए उपलब्ध समय के संदर्भ में अधिनियम की धारा 13 की उपधारा 8 के उपबंधों की ओर आकृष्ट किया जाता है।

ö.	ऋणी/बंधकर्ता/जमानतदार का नाम एवं पता	बकाया राशि (रु.)	सूचना दिनांक आधिपत्य दिनांक	अचल संपत्ति का विवरण
1.	1.श्रीमती सुनीता पति श्री भीम सेन, 2.श्री भीम सेन पिता श्री रतिराम, 3.श्रीमती राजकुमारी पति श्री बहादुर सिंह 4.श्री बहादुर सिंह पिता श्री भीम सेन 5.श्रीमती आरती पति श्री राजू 6.श्री राजू पिता श्री भीम सेन	रू. 3,07,060.25/- (रुपये तीन लाख सात हजार साठ रुपये एवं पचीस पैसा मात्र)	16.11.2022 04.03.2023	46/695 का भाग, राम नगर जगदीशपुरा, लोहामंडी वार्ड, बन्नावाली, बागईंची वाली गली आगरा, उत्तर प्रदेश - 282002 में स्थित है जिसका क्षेत्रफल 23.4 वर्ग मीटर है । चर्तुःसीमा : पूर्वः मकान पूरचन्द, पश्चिमः मकान देवी सिंह, उत्तरः प्लाट राकेश, दक्षिणः रास्ता व निकास जायदाद हाजा 12 फुट चौडा
2.	1.श्रीमती उर्मिला देवी पति श्री राजन लाल, 2.श्री राजनलाल पिता श्री हरविलाश, 3.श्रीमती सरोज देवी पति श्री मुञालाल 4.श्री मुञ्जालाल पिता श्री हरीविलाश	रू. 3,29,970.33/- (रुपये तीन लाख उनतीस हजार नौ सौ सत्तर एवं तॅतीस पैसा मात्र)	19.12.2022 04.03.2023	खसरा नं. 166 क, बाकै मौजा, कलवारी, विलासगंज, आगरा उत्तरप्रदेश 282001 में स्थित है जिसका क्षेत्रफल 100 वर्गगज है। चर्तुःसीमा ः पूर्वः प्लॉट का जुज भाग, पश्चिमः मोहन सिंह की जमीन, उत्तरः सारवान सिंहकी जमीन, दक्षिणः रास्ता 16 फीट चौड़ा

स्थान : आगरा (उत्तर प्रदेश) दिनांक : 04.03.2023

प्राधिकृत अधिकारी/ मुख्य प्रबंधक सेवा गृह ऋण लिमिटेड

आईडीएफसी फस्टे बैंक लिमिटेड

टेली: +91 44 4564 4000 । फैक्स : +91 44 4564 4022.

(तात्कालिक कैपिटल फर्स्ट लिमिटेड तथा आईडीएफसी बैंक लिमिटेड में समामेलित) सीआईएन : L65110TN2014PLC097792 पंजीकृत कार्यालय : के आरएम टॉवर्स, 8वां तल, हैरिंग्टन रोड, चेतपेट, चेन्नई-600031. IDFC FIRST

परिशिष्ट IV [नियम 8 (1)] कब्जा सूचना

जैसा कि, वित्तीय परिसम्पत्तियों के प्रतिभृतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभृति हित प्रवर्तन अधिनियम, 2002 के अंतर्गत आईडीएफसी फर्स्ट बैंक लिमिटेड (तात्कालिक कैपिटल फर्स्ट लिमिटेड तथा आईडीएफसी बैंक लिमिटेड में समामेलित) के प्राधिकृत अधिकारी के रूप में तथा प्रतिभूति हित (प्रवर्तन) नियमावाली, 2002 के नियम 3 के साथ पठित धारा 13 (12) के अंतर्गत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए अधोहस्ताक्षरी ने मांग सूचना तिथि 24.08.2022 जारी कर ऋणधारक, सह-ऋणधारकों, गारंटरों 1. श्याम कृष्ण पाठक, 2. प्रियंका पाठक को उक्त सूचना की प्राप्ति की तिथि से 60 दिनों के भीतर सूचना में वर्णित राशि 23.8.2022 को रु. 11,43,442.39/- (रु. ग्यारह लाख तैंतालिस हजार चार सौ बयालिस पैसे उन्तालिस मात्र) वापस लौटाने का निर्देश दिया था।

ऋणधारक इस राशि को वापस लौटाने में विफल रहे, अतः एतद्द्वारा ऋणधारक, तथा आम जनता को सूचित किया जाता है कि आज, 10 अगस्त, 2021 को अधोहस्ताक्षरी ने उक्त प्रतिभूति हित प्रवर्तन नियमावली 2002 के नियम के साथ पठित अधिनियम की धारा 13 की उप-धारा (4) के अंतर्गत उन्हें प्रदत्त शक्तियों का प्रयोग करते हुए अधोहस्ताक्षरी ने यहां नीचे वर्णित सम्पत्ति का सांकेतिक कब्जा कर लिया है। विशेष रूप से ऋणधारकों तथा आम जनता को एतदुद्वारा सतर्क किया जाता है कि यहां नीचे वर्णित सम्पत्ति का व्यवसाय न करें तथा इन सम्पत्तियों का किसी भी तरह का व्यवसाय रु. 11,43,442.39/- (रु. ग्यारह लाख तैंतालिस हजार चार सौ बयालिस पैसे उन्तालिस मात्र) तथा उस पर ब्याज के लिये आईडीएफसी फर्स्ट बैंक लिमिटेड (तात्कालिक कैपिटल फर्स्ट होम फाइनांस लिमिटेड तथा आईडीएफसी बैंक लिमिटेड में समामेलित) के चार्ज के अधीन होगा।

ऋणधारक का ध्यान प्रतिभृत परिसम्पत्तियों को विमोचित करने के लिए उपलब्ध समय के संदर्भ में अधिनियम की धारा 13 की उप-धारा (8) के प्रावधानों के प्रति आकृष्ट की जाती है।

अचज सम्पत्तियों का विवरण

वैशाली, सेक्टर-3, परगणा लोनी, तहसील एवं जिला गाजियाबाद (उ.प्र.) में स्थित फ्री-होल्ड प्लॉट नं. III-एफ/273 पर निर्मित भूतल, कवर्ड एरिया 28 वर्ग मी. पर सम्पत्ति/प्लैट (छत के अधिकार के बिना) का सम भाग तथा हिस्सा तथा चौहद्दी : पूर्व : प्लॉट नं. III-एफ/301, पश्चिम : 19 फीट चौड़ा रोड, उत्तर : प्लॉट नं.III-एफ/272, दक्षिण : प्लॉट नं. III-एफ/274

तिथि: 3 मार्च. 2023 स्थानः गाजियाबाद ऋण खाता सं.: 10217627

प्राधिकत अधिकार्र आईडीएफसी फर्स्ट बैंक लिमिटेड (तात्कालिक कैपिटल फर्स्ट लिमिटेड तथा आईडीएफसी बैंक लिमिटेड में समामेलित

SUZLON

Suzlon Energy Limited

Registered Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 028, Maharashtra, India Tel: +91 20 6702 2000; Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com; Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28th September 2022. read with addendum dated 10" October 2022 filed with the BSE Limited ("BSE") and the National Stock Exchange of India Limited ("NSE"), the stock exchanges, where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as "Stock Exchanges") and the Securities and Exchange Board of India ("SEBI").

FIRST AND FINAL CALL NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9040H01011) OF SUZLON ENERGY LIMITED AS ON THE RECORD DATE, I.E., THURSDAY, 2ND MARCH 2023.

This is to inform that the Securities Issue Committee of the Board of Directors of the Company at its meeting held on Friday, 24th February 2023, approved making of the First and Final Call of ₹ 2.50 (Rupees Two and Paise Fifty Only) per Rights Equity Share (out of which ₹ 1.00 will be adjusted towards the face value and ₹ 1.50 will be adjusted towards securities premium) ("First and Final Call") on the outstanding 240,00,00,000 (Two Hundred Forty Crores) partly paid-up equity shares of the Company having a face value of ₹ 2.00 each with ₹ 1.00 paid-up ("Rights Equity Shares"), which were allotted on 31" October 2022 on a rights basis pursuant to the Letter of Offer dated 28"

September 2022 read with addendum dated 10th October 2022. Further, Thursday, 2" March 2023, has been fixed as the "Record Date" for the purpose of determining the holders of partly paid-up Rights Equity Shares to whom the call notice for the payment of First and Final Call will be sent. The

same was intimated to the stock exchange on Friday, 24" February 2023. In terms of the provisions of the Companies Act, 2013, read with the relevant rules made thereunder (the "Act"), the Company has sent the First and Final Call Notice in the electronic mode to the members holding partly paid-up equity shares whose e-mail address is registered with the Company or the Registrar and Transfer Agent ("RTA") or Depository Participant(s) on the Record Date unless the members have registered their request for the hard copy of the same. Physical copy of the First and Final Call Notice along with instructions and ASBA form have been sent vide permitted modes of despatch, at the registered addresses of those shareholders (a) who have not registered their e-mail address with the Company or the RTA or the Depository Participant(s); or (b) who have specifically registered their request for the hard copy of the same. The Company has completed the despatch on 4"March 2023.

Accordingly, the details regarding making payment for First and Final Call are given below:

Call Money	From	То	Duration		
Payment Period	Thursday, 9th March 2023	Thursday, 23 rd March 2023	15 Days		
Mode of Payment	 (a) Online ASBA: by visiting the website of SCSBs* offering the online ASBA facility; (b) Physical ASBA*: by submitting the duly filled up ASBA Form at the designated branch of the SCSBs*; 				
	(c) Payment through 3-in-1 account: by using 3-in-1 type accounts, provided by some of the registered brokers.				
	*Please visit https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes Id=34 to refer to the list of existing SCSBs (for points (a) and (b) above).				
	"Please Visit Company's website <u>www.suzlon.com</u> or RTA's weblink https://rights.kfintech.com/callmoney to download the Physical ASBA application.				

In accordance with SEBI Circular no. SEBI/HO/CFD/DIL1/CIR/238/2020 dated 8th December 2020, shareholders can also make a call money payment by using of linked online trading-demat-bank account (3-in-1 type accounts) provided by some of the brokers. Shareholders must login in to their demat account and choose the name of the company "SUZLON ENERGY LIMITED" and further click on the option to 'Make Call Money Payment' and proceed accordingly. Shareholders to note that this payment method can be used only if the concerned broker has made the facility available to their customers. The Company or the Registrar will not be responsible for non-availability of this payment method to the shareholders.

The BSE and NSE have issued notices for suspension of trading in ISIN IN9040H01011 representing partly paid-up equity shares of the Company comprising of ₹ 2.50 (Rupees Two and Paise Fifty Only) with effect from 2rd March 2023 and accordingly the ISIN IN9040H01011 representing partly paid-up equity shares has been suspended by National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL).

Upon completion of the corporate action, the partly paid-up equity shares shall be converted into fully paid-up equity shares and would be credited to ISIN INE040H01021, allotted by NSDL/CDSL.

All correspondence in this regard may be addressed to KFin Technologies Limited, Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India, Tel. No.+91 40 6716 2222; Toll Free No.1800 309 4001; Email id: einward.ris@kfintech.com; website: www.kfintech.com; Contact Person: M Murali Krishna.

For Suzlon Energy Limited

Geetanjali S.Vaidya Company Secretary

Adfactors 590

www.readwhere.com

स्थान : नई दिल्ली

कंपनी सचिव और वरिष्ठ उपाध्यक्ष कॉर्पोरेट मामले

Date: 4th March 2023

Place : Pune

(अचल सम्पत्ति के लिये)

ગાયને મારનાર વ્યક્તિ નરકમાં સડે છે

અલ્હાબાદ હાઈકોર્ટના મુસ્લિમ જજે કહ્યું- ગૌહત્યા પર પ્રતિબંધ હોવો જોઈએ

અલ્હાભાદ, તા. પ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સૂચન કર્યું છે. કોર્ટ કહ્યું, ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. તેથી ગાયોની સુરશાને હિન્દુઓના મૌલિક અધિકારમાં અપ્રેલ હત્વી જોઈએ હોર્ટ હતાં ગામેલ કરતી જોઈએ કોર્ટેક્ઠા<u>ં</u> સામલ કરવા જાઇએ. કાટ કહ્યુ-અમને આશા છે કે કેન્દ્ર સરકાર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને ગાયોને સંરક્ષિત

લગાવવા અને ગાયાન સરાક્ષત રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે જલદી યોગ્ય નિર્ણય લેશે. ગૌ હત્યાના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ શમીમ ાલ્પજ્ઞા કરા હતા. જાસ્ટ્સ સમામ અહેમદે ૧૪ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ પ્રિવેન્શન ઓફ કાઉ સ્લોટર એક્ટ, ૧૯૫૫ હેઠળ એક વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ ાયરજી રાજ્યાસ કાયપાહાય પર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, "અમે એક ધર્માનિરપેશ દેશમાં રહીએ છીએ અને તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ."

દેવીય અને પ્રાકૃતિક ઉપકારની પ્રતિનિધિ છે. તેથી તેની રક્ષા અને સન્માન કરવું જોઈએ. મહત્વનું છે કે અરજીકર્તા બારાબંકી નિવાસી મોહમ્મદ અબ્દુલ ખાલિકે પોતાની અરજીમાં દલીલ આપી હતી કે

જસ્ટિસ શમીમ અહમદે કહ્યું-આપણે એક ધર્મનિરપેક્ષ દેશમાં રહીએ છીએ અને દરેક ધર્મોનું સન્માન હોવું જોઈએ

પોલીસે કોઈ પૂરાવા વગર તેના પર કેસ કર્યો છે. તેથી તેની વિરુદ્ધ એડિશનલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ્દ કરવી રહેવા કાર્યપાહારા રહે કર્યા જોઈએ. અરજીને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું હતું કે, "રેકર્ડ પરના તથ્યો પ્રથી, અરજદારસામે પ્રથમ દષ્ટિએ કેસ કરવામાં આવે છે." આ કેસમાં જસ્ટિસ શમીમ અહેમદે કહ્યું, "હિંદુ ધર્મમાં ગાયને દૈવી ભેટ તરીકે વર્જાવવામાં આવી છે. દંતકથા

વચ્ચેના સમુદ્ર મંથનથી ગાયની ઉત્પત્તિ થઈ હતી. તેને સોંપવામાં આવી હતી." ન્યાયાધીશે વધુમાં ઉમેર્યું, "ગાયને વિવિધ દેવતાઓ સાથે પણ સાંકળવામાં આવી છે. ખાસ કરીને ભગવાન શિવ. જેનો પર્વત નંદી એક બળ દ છે. ભાગવાન વવત નદા અંક ખળદ છે. લગવાન ઈન્દ્ર કામધેનુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભગવાન કૃષ્ણ તેમની યુવાનીમાં ગાયો ચરતા હતા." ન્યાયાધીશ શમીમ અહમદે કહ્યુ-

ન્યાયાધીશ શમીમ અહમદ કહ્યું ગાયના પગને ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. તેના દૂધમાં ચાર પુરૂષાર્થ ધિર્મ, અર્થ, કામ અને મોશ) નું મિશ્રણ હોય છે. વૈદિક કાળથી ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયની મહાનતાનો ઉલ્લેખ મહાભારત અને વેદોમાં પણ છે. ભગવાન રામને પણ ગાય ભેટમાં મળી હતી. તેમણે કહ્યું- જે પણ ગાયને મારે છે કે બીજાને તેને મારવાની મંજરી આપવામાં આવે છે, તેણે વર્ષો સુધી નરકમાં ભોગવવું

તામિલનાડુના ક્રયાકુમારી જિલ્લામાં આવેલા મોન્ડાઈકકડુ ભગવતી અમ્મા મંદિરમાં રવિવારે યોજાયેલી માહત કોડાઈ ફેસ્ટિવલમાં તેલંગાણા અને પુંડુચેરીના રાજ્યપાલ તમિલીસાઈ સુંદરરાજન પણ અન્ય શ્રધ્ધાળુઓ સાથે ઉજવણીમાં સામેલ થયા હતા.

ફેક ન્યુઝ ફેલાવવાના આરોપો એશિયાનેટ ન્યુઝની કોચી ઓફિસ પર પોલીસના દરોડા

અમેરિકનોનો હેતુ હતો, ત્યારે એક વિશ્વાસ, દેશભક્તિ, સખત મહેનત, પરિવાર માટે કંઈક્

નહનત, પારપાર નાટ કઇક કરવાની ભૂખ હતી, જે હવે દૂર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રામાસ્વામીની જેમ નિક્કી હેલી અને ટ્રમ્ય પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

છ. રામાસ્વામીએ કહ્યું કે, અમેરિકા આજે ત્રણ બિનસાંપ્રદાયિકવિશ્વસાથે ઝઝૂમી

રહ્યું છે: જાતિ, લિંગ અને આબોહવા. પ્રથમ, તેમણે કહ્યું, "વંશવાદ" છે જેમાં અમેરિકનો કોઈને તેમની

ચામડીના રંગ દ્વારા ઓળખે છે. જો

ચાનડાના સ્પદ્ધારા આગવા છે. જે કોઈ કાળો હોય તો તે હલકી ગુણવત્તાવાળા હોય છે અને જે ગોરો હોય તે સ્વાભાવિક રીતે

ગાસ હાય તે સ્વાગાવક સા વિશે પાયિકૃત હોય છે. રામાસ્વામીએ લિંગ ભેદભાવ અને આબોહવા પરિવર્તનનો મુદ્દો પણ

ઉઠાવ્યો હતો.

એશિયાનેટ ન્યૂઝની કોચી ઓફિસમાં કેરળ પોલીસે રવિવારે દરોડા પાડ્યા હતા. ધારાસભ્ય પીવી અનવરની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, એશિયાનેટે સગીર છોકરીનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ બનાવીને તેને ફેલાવ્યા હતા. આ કેસમાં પોલીસે નકલી, પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

દરોડા બાદ હજુ સુધી પોલીસનું નિવેદન આવ્યું નથી. જયારે, એશિયાનેટ ન્યૂઝના પ્રમુખ રાજેશ કાલરાએ કહ્યું હતું કે પોલીસ નકલી કેસમાં દરોડા પાડી રહી છે. તેમણે કહ્યું હતું કે અમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારું સમાચાર જથ તેની સામે કાયદાકીય પગલાં લેશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગતા રામાસ્વામી

ચૂંટાઈશ તો અમેરિકામાં એફબીઆઈ

એને શિક્ષણ વિભાગ બંધ કરીશ

અમેરિકાની સ્વતંત્રતા જાહેર

કરવાને બદલે ચીનથી આઝાદીની વાત કરા હાત. તમને જણાવી દઈએ કે જેફરસન એક અમેરિકન રાજકારણી, રાજદ્વારી, વકીલ,

અમેરિકા મુશ્કેલીમાં

હોવાનો

રામાસ્વામીનો દાવો

આર્ફિટેક્ટ કિલો ગોકર અને

અમેરિકાના સ્થાપક નેતાઓમાંના એક હતા. તેમણે ૧૮૦૧ થી

૧૮૦૯ સુધી અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને સ્વતંત્રતા માટે અવાજ

ારપાબ્લકન નતાએ કહ્યું ક અમેરિકા રાષ્ટ્રીય ઓળખ સંકટનો સામનો કરી રહ્યું છે. તેણે કહ્યું કે હું ૩૭ વર્ષનો છું અને મારી પેઢીના

SUZLON

Suzlon Energy Limited

Registered Office: "Suzion", 5, Shrimal Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedahad - 380 009, Gujerat, India: Tel: -161 79 8604 5000; Corporate Office: One Earth, Hadapsar, Pune - 411 1028, Maharashtra, India Tal: +91 20 6702 2000; Contact Parson: Gestanjali S. Vaidya, Company Scordary and Compliance Office: E-mall: Investors@auzkin.com; Website: www.suzion.com; Corporate Identity Number: 1.4010/3.1959F.(002547

IRST AND FINAL CALL NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9040H01011) OF SUZLON ENERGY LIMITED AS ON THE RECORD DATE, I.E., THURSDAY, 2™ MARCH 2023.

This is to inform that the Socurities issue Committee of the Board of Directors of the Company at its meeting held on Friday, 2R February 2023, approved making of the First than Final Call of \$2.00 (Rupees Two and Paise Filly City) per Rights Equily Street could wink in \$7.00 the adjusted towards the fine outside and \$7.50 (Rupees Two and Paise Filly City) per Rights Equily Street could wink in \$7.00 the adjusted towards the fine outside and \$7.50 will be adjusted towards the fine outside and \$7.50 will be adjusted towards to fine outside and \$7.50 will be displayed per adjusted to fine of the Company in thempty all box value of \$2.00 mich with \$7.50 paisety (Prights Equily paid or specified to fine Company in the rights of the Company in the specified or \$7.50 mich with \$7.50 paisety (Prights Equily September 2022 read with addendum dated 10" Coldoor 2022.

Felter's Turnaday 2022 read with addendum dated 10" Coldoor 2022.

same was infrinshed to the stock exchange on Hriday, 24" in brush y 2023.

In thems of the provision of the Companish Act, 2013, read with the relevant rules made thereunder (the "Act"), the Company has sent the First and First Call Notice in the electronic mode to the members holding partly paid-up equity harses whose e-mail address is migistered with the Company or the Registers and Transfer Agent ("RTA") or Depository Participant(s) on the Record Dela unless the members have registered their request for the hard copy of the seam. Physical copy of the First and First Call Notion callow with instructions and ASBA form have been such permitted modes of despatch, at the registered addresses of those shareholders (a) who have not neglected their e-mail address with the Company or the RTA or the Depository Participant(s) or (a) who have specifically registered their request for the hard copy of the same. The Company has completed the despatich on 4"March 2023.

September ZVZZ pead with abosehoum dates of the October ZVZZ.

Further, Thursday, Z*March 2023, has been fixed as the "Record Date" for the purpose of determining partly paid-up Rights Equity Shares to whom the call notice for the payment of First and Final Call will same was inlimited to the slock exchange on Friday, 24th February 2023.

Accordingly, the details regarding making payment for First and Final Call are given below

interexp, in the Ornied States on Armeter of the State of

ઉઠાવ્યો હતો. ાપ્યાહતા. રિપબ્લિકન નેતાએ કહ્યું કે

ભારતમાં કૅન્સરના કારણે સ્થિતિ ગંભીર : આઈસીએમઆરની ચેતવણી

દેશમાં છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી સતત વધી રહી છે. આઈસીએમઆરના રિપોર્ટ છે. ત્યારેલા વર્ધા સ્વાર મુજબ કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈરહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું કહેવું છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસોમાં ૧૨.૭ ુ ટકાનો વધારો થઈ શકે છે. કેન્સર થવા પાછળ સૌથી પહેલુ કારણ ધૂમ્રપાન, તમાકુ અને દારુનું સેવન, મોટાપા, શરીરમાં પોષક તત્વોની ઉજ્ઞય અને શારીરિક એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

સીએમઆર દ્વારા આ બાબતે ચિંતા સાથે જણાવ્યુ હતું કે, દેશમાં આવતાં ત્રણ વર્ષોમાં કેન્સરના કેસો ખૂબ ઝડપી વધવાની શક્ચતા છે અને આ ભયાનક બીમારીથી કેવી રીતે બચવુ. છેલ્લા કેટલાક સમયથી દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સતત કેન્સરન દર્દીઓની સંખ્યામાં વધારો થત સતત કેન્સરના નિષ્ણાતો આ પ્રકારની આગાહી

હોબાળો મચી ગયો છે. કોરોના

વાયરસ બાદ નવો રોગચાળો કાટી

વાયરસ બાદ નવો રોગ્યાળો કાટી નીકળવાની કાશતાથી લોક ડી રહ્યા છે. કલોદિશના આરોગ્ય વિભાગે યુષ્ટિ કરી છે કે શાલંદિ કાઉન્દીમાં એક વ્યક્તિનું કે એ અમીઆના કારણે મૃત્યુ થયું હતું. તેને નેગલેરિયા કાઉલેરી પણ કહેવામાં આવે છે. આ મીત ભાદ ક્લોદિશ હેલ્લ ડિપાર્ટમન્ટે શાલંદિ કાઉન્દીના લોક માટે તેનલાથી ભા જારી કરી છે. આ પહેલા દક્ષિણ જારી કરી છે. આ પહેલા દક્ષિણ જારી કરી છે. આ પહેલા દક્ષિણ

જારા કરા છે. આ પહેલા દાશૈણ કોરિયાના એક નાગરિકનું પણ બ્રેઈન ઈટિંગ અમીબાના કારણે મોત થઈ ચૂક્યું છે. આ વ્યક્તિ મૃત્યુના થોડા દિવસ પહેલા જ થાઈલેન્ડની યાત્રા પરથી ઘરે પરત

ફર્યો હતો. ફલોરિડા ડિપાર્ટમેન્ટ ઑફ

હેલ્થના પ્રેસ સેક્રેટરી જય વિલિયમ્સે

હેલ્લા પ્રેસ સેક્ટરી જ્યા વિલિયમ્સે જલાવ્યું હતું કે રોગ ચાળાની નિખ્યાત છી મેં ચેપના સંજીઓને સમજવા માટે તપાસ કરી રહી છે. હું પુષ્ટિ કરી શહે છું આ કમનાલીખ મુત્તુ મેગલેરિયા કાઉલેરીને કારણે થયું છે. અમે મૃતકની ઓળખ બચાવવા માટે તેનું નામ જાહેર કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે કે કું એમ પણ કહ્યું કે કે કું એમ પણ કહ્યું કે કે કું હું આ કમનાલી પૃષ્ટિ થઇ હતી. તે નળના પાશીના ઇપયોગ અને માર્ગ્ય ચૂંટવાની ટેવ સાથે સંબંધિત હોઈ શકે છે. જો કે, વિગતવાર માહિતી તપાસ બાદ જે શેર કરવામાં આવશે.

શરકરવામાં આવશે. મગજ ખાનારા અમીબાથી મૃત્યુની પુષ્ટિ બાદ, આરોગ્ય અધિકારીઓએ માત્ર ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપી છે.

..... તેમણે સલાહ આપી છે કે ઓછામાં ઓછા એક મિનિટ માટે નળના

૨૦૨૦માં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના મામલે ૨૦૨૦માં ૧૩.૯૨ લાખ એટલે કે લગભગ ૧૪ લાખ દર્દીઓ હતા જ્યારે ૨૦૨૧મા

વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાં કૅન્સરના કેસોમાં ૧૨.૭ ટકાનો વધારો થવાની શક્યતા

વધીને ૧૪.૨૬ લાખ થયા હતા અને વર્ષ ૨૦૨૨માં ૧૪.૬૧ લાખ સુધી આ આંકડો પહોચી ગયો હતો. આ બાબતે નિષ્ણાતોના મત

મુજબ, દેશમા હદય રોગ અને શ્વાસના રોગોની બીમારી જ નહી પરંતુ કેન્સરની બીમારી પણ ખૂબ ઝડપી ફેલાઈ રહી છે. કેન્સરના વધતા પ્રકોપ માટે ધણા કારણો જવાબદાર છે. જેમા વધતી ઉમર, જીવનશૈલીમાં બદલાવ વ્યાયામ

મૃતક દર્દી થોડા દિવસ

. પહેલા થાઈલેન્ડના

ભારતના છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પ્રમાણે વર્ષાના આકડાઓ પ્રમાણ ભારતમાં પુરુષોમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે. ભારતમાં પુરુષોમાં સૌથી વધુ કેન્સર મોંઢા અને ફેફસાના કેન્સરનાકેસ વધારે જોવા મળે છે. કન્સરના કસ પવાર જાવા મળછ. જ્યારે મહિલાઓમાં સૌથી વધારે સ્તન કેન્સર અને ગભશિયના કેન્સરના કેસ વધુ જોવા મળે છે. કેન્સરના રોગથી બચવા માટે નિષ્પ્રાતોના અભિપ્રાય મુજબ,

લોકોએ તમાકુ અને દારુથી દુર રહેવું જોઈએ. આ સાથે સંતુલન આહાર અને રોજ વ્યાયામ કરવો જોઈએ અને જો તમારી ફેમીલીના જીઇએ એમ જાતામારુમાલામાં ઈતિહાસમાં કોઈને પણ આ બીમારી હોય તો તમારે સત્વરે તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત વાતાવરણમાં કેમિકલ્સ, પ્રદૂષણ, સૂર્યના હાનિકારક યુવી કિરણાં, ખરાબ અને વાસી ખોરાક, શારિરીક પ્રવૃતિ બંધ ખરાબ અને વાસી કરવી વગેરે જેવા કારણો જવાબદાર ગણાય છે

બ્રેઈન ઈટિંગ અમીબાના રોગથી અમેરિકામાં પહેલું મોત થતાં હોબાળો મગજ ખાતી અમીબાને નેગલેરિયા ફાઉલેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ઉપયોગ કરતા પહેલા તેને ઠંડુ કરો. જય વિલિયમ્સ વધુમાં જણાવે છે કે આળખવામાં આવે છે. તે એક કોષીય સજીવ છે, જે ફક્ત ગરમ અને મીઠા પાણી અથવા જમીનમાં જોવા મળે છે. સરોવરો, નદીઓ અને ભુઉષ્મીય ગરમ ઝરણા જેવા

પહેલા થાઇલ જેવા પ્રવાસેથી પરત આવ્યો હોવાના અહેવાલ નેગલેશ્યા કાહેશેરીનો ચેપ દર્લભ છે અને તે ત્યારે જ થઈ શકે છે જ્યારે અમીબાથી દૃષિત પાણી નાક કારા અનીબા ના કારા શરીરમાં પ્રવેશ શરીરમાં પ્રવેશ છે. તમે નળનું પાણી કરે છે.

એડલવેઈઝ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

રાજ્યકે એકિંગટ સવર ૩, વીંગ મી, કોતીનુર સીરી મોલ, કોતીનુર, કીરોલ રોડ, કુર્લા (વિધમ), મુંગઈ-૪૦૦૦૦૦૦ શાખા ક્રાયાંલય એકલવેઈ.ત લાઉર્લિંગ ફાયનાના લીમીટેડ, ઓકીસ ૩૦૧-૩૦૪, ૩જા માર્ગ, આઈ વીંડન મીકદીગ, આઈ આઈએમ પાસે, પાંજરાપ ઇ-પારરાજી — સંવૈધાનિક ૩૦ દિવસની વેચાળ નોટીસ

જયોતિ ક્રિશોરભાઇ હરવાલી (સહ- 03.03.૨૦૨૭ના રોજ હજાર ત્રલસો યુમોટર કરતો અર્નેસ્ટ મની સવારે ૧૧ થી ભપોરે સવારે ૧૧ થી દરભલા અને આપેલ્લામાં આપલામાં રે. ૨૨,૩૯,૮૦૪.૦૪ (પ્રિયોનીશ-૨,૧૮૦૪-૦૦) અને આપેલ્લામાં મુખ્ય છે. આપેલ મામ મુજ લો (પ્રિયોનીશ-૧ મામોરે ૧૦૦	ŀ	5H	કરજદાર(શે)/ સત-કરજદાર(શે) અને જામીનદાર(શે)ના નામ	વસૂલાતની ૨કમ	અનામત કિંમત અને ઇએમડી	હરરાજની તારીખ અને સમય	નિરીથણની તારીખ અને સમય	ભીતિક કબજાની તારીખ
હરવાલી (સહ-૧૨૧૬દાર), અને કરિયાર્થન આડોક્રુમાર હરવાલી લિલ-૧૨૧૬દાર) આડોક્રુમાર હરવાલી લિલ-૧૨૧૬દાર) હર્માર સ્વર્યાસ સુધી તેના પર આગળનું ભાજ કાનુની ખર્ચ		3	જયોતિ કિશોરભાઇ હરવાલી (સહ- કરજદાર) અને અશોકકુમાર ખુશાલદાસ હરવાલી (સહ-કરજદાર), અને કવિતામેન	૦૩.૦૩.૨૦૨૩ના રોજ ૩. ૨૨,૩૯,૮૦૪.૦૪ (૩. બાવીસ લાખ ઓગલચાલીસ હજાર આઠસો યુમોતેર અને પૈસા ૭૪ ફક્ત) લોનના લેલાની	હજાર ત્રણસો ચૂમોટર ફક્ત) અર્નેસ્ટ મની ડીપોઝીટ: રૂ. ૧,૮૩,૪૩૦/- (રૂ. એક લાખ ત્ર્યાસી હજાર ચારસો સાડત્રીસ ફક્ત)	સવારે ૧૧થી બધોરે ૧૨ વચ્ચે (૫ મિનિટના અમર્થાદિત ઓટો	સવારે ૧૧ થી બપોરે ૩.૦૦	13.11.2022

વૉશિંગ્ટન, તા. પ અમેરિકામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક

રામાસ્વામીએ આજે કહ્યું છે કે, અમેરિકા મુશ્કેલ સ્થિતિમાં છે.

તમારો કુરકડા મસ્તારા તેમ તમારો કહ્યું કે અમેરિકા ત્રણ બાબતોના કારણે મુશ્કેલીમાં છે. જાતિ, લિંગ અને આબોહવા આ સાથે વિવેકે કહ્યું કે જો ૨૦૨૪માં દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તો

દર્શના રાષ્ટ્રપાત તરાક યુટાપા તોઓ એફબીઆઈ તેમજ શિક્ષા વિભાગને ખાતમ કરવાનું કામ કરશે. તમને જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટીના નેતા રામાસ્વામીએ ગયા અઠવાડિયે જ

રામાસ્વામાંએ ગયા એઠવાડિય જ ૨૦૨૪ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રિપબ્લિકન નેતાઓને સંબોધતા રામાસ્વામીએ કહ્યું કે તેઓ અમેરિકન કંપનીઓને ચીધ સાથે કારોબાર કરવા પર પ્રતિબંધ

મુકવા માટે પણ પ્રથમ કાર્યવાહી

તુક્યાં નાટ વડા પ્રવપ કાવનાલા કરશે. તેમણે કહ્યું કે આજે અમેરિકામાં ચીની કંપનીઓનો બિઝનેસ વધી રહ્યો છે અને તેને રોકવાની જરૂર છે. રિપબ્લિકન

૧૩૦૦ કર્મચારીઓની છટણી પછી

ઝૂમ કંપનીના પ્રમુખ ગ્રેગની એકાએક કરાઈ હકાલપટ્ટી

સાન જોસ, તા. પ વિશ્વભરમાં મંદીના એંધાલ વચ્ચે મોટી મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છછ્છી કરી રહી છે. જેમાં મોટી ટેક કંપની માની એક ઝૂમે પણ ગત મહિને ૧૩૦૦ કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. આ બધા વચ્ચે કંપનીના સીઈઓએ હતે કંપનીના પ્રમુખ ગ્રેગ ટોમ્બની એકાએક નોકરીમાંથી છછ્છી કરી છે. કંપનીના પ્રમુખ ગ્રેગ ટોમ્બની છછ્છી અંગે વાત કરવામાં આવે તો.

હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી. આ અંગે માહિતી તેમની નિયમનકારી ફાઇલિંગમાં કરવામાં આવી છે. જૂન ૨૦૨૨માં જ શ્રેગ ટોમ્બનની આ પોસ્ટ માટે નિ્મર્શૂક થઇ હતી. એટલે કે ટોમ્બનો કાર્યકાળ હજુ ૧ વર્ષ પણ પૂરો થયો ન હતો.

પણ પૂરા થયા ન હતા. ઝૂમ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ ટોમ્પ્સની જગ્યાએ હજુ કોઈ નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી નથી. જો કે કંપનીએ ટોમ્બને હટાવવા પાછળનું કારણ જણાવ્યું નથી. ટોમ્પ્સ ઓગસ્ટ ૨૦૧૯માં કંપનીના મુખ્ય રેવન્યુ અધિકારી તરીકે ઝૂમમાં જોડાયા હતા. આ અગાઉ શ્રેગ ટોમ્બે ગૂગલમાં સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ, જિયો ઈન્ટરપ્રાઈઝમાં પણ વાઈસ પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે.

પાકિસ્તાનીએ એક ભારતીય યુવકને દુબઈમાં બંધક બનાવ્યો

યુવકે પાકિસ્તાની સલૂન ઓપરેટર પર તેને નકલી લોન અપાવવાનો આરોપ પણ લગાવ્યો છે. પીડિતે મદદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને વડાપ્રધાન, યુપીના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને દુબઈથી સુરક્ષિત રીતે ભારત લાવવાવિનંતી કરી છે.

મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરતગંજ શહેરમાં રહેતા મોહમ્મદ રિઝવાને શનિવારે વિદેશમાં નોકરી મેળવવા માટે ભારત સરકાર પાસેથી મદદનો વિડીયો વાયરલ કર્યો છે. દુબઈના સરૈયા શહેરમાં ઈકબાલ રેસ્ટોરન્ટમાંથી, રિઝવાન તેની સાથે થઈ રહેલી હેરાનગતિનો વિડીયો બનાવીને સુરક્ષિત રીતે ભારત પાછા આવવાની વિનંતી કરતો જોવા મળે છે. આરોપ છે કે માલિકે છેતરપિંડી છે. બારાય છે 3 માલિક છતારાય ક કરીને તેના નામે લોન મેળવી હતી અને તેને હોટલના રૂમમાં બંધક બનાવી રાખ્યો હતો જયાં તે કામ કરતો હતો.

.... દુબઈમાં ફસાયેલા રિઝવાનના ૧ઈ ઈરકાને જિલ્લા ભાઈ ઈરફાને જણાવ્યું કે ૧ હિસેમ્બર, ૨૦૨૨ના રોજ દુબઈમાં ાસન્યર, ૧૦૨૧ના સજ્જુનાગન નામના પાકિસ્તાની વ્યક્તિએ તેને ફોન કર્યો હતો. ત્યાં પહોંચીને નોકરીના બહાને પાકિસ્તાની સલૂન માલિકે છેતરપિંડી કરીને તેના નામે ૩૬ હજાર દિરહામ (૭ લાખ પદ

ભારાભંકી, તા. પ હજાર)ની લોન મેળવી હતી. આ ઉત્તર પ્રદેશના ભારાભંકી પછી તેને ઈક્બાલ હોટલ પાસેના જિલ્લાના એક યુવકે દુબઈમાં એક રૂમમાં બંધક બનાવી રાખ્યો પાકિસ્તાનીઓ પર બંધક બનાવી હતો. ઓગણે પઠે સેવનુ માર્થિકે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. રિઝવાનના તમામ દસ્તાવેજો અને વિઝા પોતાની પાસે રાખ્યા છે.

> નામ બદલેલ છે મેં મારૂ નામ હેતલબેન ધવલ સોની થી બદલીને હેતલ ધવલભાઈ સોની

નામુંઃ એફ/૧-૩૦૧, આશ્રય-૧૦, ર મંદિર પાસે, કાળીગામ, અમદાવાદ

નામ બદલેલ છે મેં મારૂ નામ બેન ધવલ સોની થી બદલીને હેતલ ધવલભાઈ સોની રાખેલ છે. સરનામું: એફ/૧-૩૦૧, આશ્રય-૧૦,

ખોડીયાર મંદિર પાસે, કાળીગામ, અમદા નામ બદલેલ છે મેં મારૂ નામ ભક્ર જયોતિન્દ્રકુમાર બદલીને

જ્યોતિન્દ્ર મહેશભાઈ ભક્ટ રાખેલ છે સરનામું: ૫૩/૩, બીમાનગર સોસાયટી, સરનામું: ૫૩/૩, બ્રીમાનગર સોસાયટી, ૧૭૨૨-૩, સેટેલાઇટ અમદાવાદ, ૩૮૦૦૧૫ એફીડેવિટ નં. ૮૦૬ તા. ૨-૩-૨૦૨૩ નોટરી શિલ્પા પી. શાહ, અમદાવાદ

नाम लहतेत छे में माउू नाम થી બદલીને

મક પલ્લવી જચોતિન્દ્ર રાખેલ છે સરનામું: ૫૩/૩, બીમાનગર સોસાયટી, સેક્ટર-૩, સેટેલાઈટ અમદાવાદ, ૩૮૦૦૧૫ એફીડેવિટ નં. ૮૦७ તા. ૨-૩-૨૦૨૩ નોટરી શિલ્પા પી. શાહ, અમદાવાદ

Edelweiss

Date: 4th March 2023 Place : Pune

From To
Thursday, 9th March 2023 Thursday, 23rd March 2023 (a) Online ASBA: by visiting the website of SCSBs* offering the onlin (b) Physical ASBA*: by submitting the duly filled up ASBA Form a branch of the SCSBs*.

(c) Payment through 3-in-1 account: by using 3-in-1 type accounts, some of the registered brokers.

riease visit intiss/iwww.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedf Id=34 to refer to the list of existing SCSBs (for points (a) and (b) above). "Please Visit Company's website www.suzion.com or RTA's weblink https://inghts.kitintech.com/calimoney to download the Physical ASBA a

In accordance with SEBI Circular on SEBIOHOCPDIDI.1.10(1928)2200 dates a Celebratic Sebiohocp and Circular on SEBIOHOCPDIDI.1.10(1928)2200 dates of Sebiohocp 2009, shearhold calls on make a call money sysyment by using of linked on fine trading-densel-bank account (3-k-1 type accounts) provide by some of the brokens. Shareholders must login in to their densel account and chose the name of the critical sebiohocp 2009. The control of the c

the Brain arrows.

The BSE and NSE have issued notices for suspension of trading in ISN N8040H01011 representing parity paid-up-equity shares of the Company comprising of \$2.50 (Rupses Two and Paise Fifty Only) with effect from 2" March 2023 and accordingly the ISN 189040H01011 representing parity paid-up-equity shares has been suspended by National Securities Depository Limited (NSDL) and Central Depository Services (finds) Limited (CDSL).

Upon completion of the corporate action, the partly paid-up equity shares shall be converted into fully paid-up equity shares and would be credited to ISIN INE040H01021, allotted by NSDL/CDSL.

All correspondence in this regard may be addressed to KFin Technologies Limited, Selenium Tower B, Plot No.31 and 32, Flanandal District, Nanakramguda, Rangaraddi-500032, Telangana, India, Tel. No.491 40 6716 2222; Toll Free No.1800 309 4001; Email id: einward.ris@kfintech.com; website: www.kfintech.com; Contact Person: MMurali Mistina.















